

REGISTERED No. B. 156

# શ્રી રત્નધર્મ પ્રકાશ.

कर्तव्यं जिनवन्दनं विधिपर्हणोद्भासनमानसैः ।  
 सद्यास्त्रिविनूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ॥  
 श्रेत्रव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं ।  
 इनादौ व्रतपाद्मनं च सततं कार्या रतिः श्रावकैः ॥ १ ॥

“ લિખિત વિષે તત્પર અને દર્શાવી ઉદ્દેશિત ભનવાળા આનંદાચે પ્રતિદિન શ્રી જિન્-  
એટને બાન કરું, ચતુર ચારિનાડે સુરોનિનત અથવા મુનિનાની ખાત સેવા કરવી, ભિરણ-  
નીંના નુકસ ઉદ્ગાર જિન્વાયન પ્રતિદિન ખાંબળવું અને દાનાદાઢિક. (ધાન, ધીર તપ અને  
કાળજી ને લિખે તથા અદ્વિતાદિક વતને પાળવામાં નિરંતર આસ્કરિત રાખવા.)”  
સુરામુખતાપલિ.

मुख्य रह मुँ. कार्तिक संवत् १८५७, शाके १८३२, अंक ८ नो।

ପ୍ରାଚୀକରଣ

શ્રી નૈનધર્મ પ્રસારક સભા, લાવનગર.

जावलगर—आनंद एन्टीज प्रेसमां छायु.

સાહિત્ય ભૂલ્ય રૂ. ૧ ) પોર્ટલ ચાર આના.

## सभा तरफथी छपाता-छपावाना ग्रंथोः

नीचे ज्ञानवेदा अथा तैयार थना आवा छे ते थोडा वर्षतमां बहार पडो.  
१ श्री कर्मचांथ सटीक-विलाग पहुळो-यार कर्मचांथ.

शेठ रत्नश्च वीरश्च तथा अनुबाध नेचंदनी सहायथी.

२ श्री प्रशमरति सटीक.

शेठ हरश्वन शुग्ण नवुद्योगानिवासी गृहस्थनी सहायथी.

३ श्री योगमिहु सटीक.

सुखाविडा देवलीआठनी सहायथी.

४ श्री उपदेशमाणा मूण तथा शिक्षना लापांतर युक्ता.  
आवनगरना अविकासमुदायनी सहायथी.

५ श्री उपदेशप्रासाद लाग ५ में ( रथंब २० थी २४ ) पूर्ण.

नीचे ज्ञानवेदा अथा थोडी सुदत पढी बहार पडो.

६ श्री शांतिनाथ चरित गद्यअंध. भूग.

श्री लीभीना संघनी सहायथी.

७ श्री कर्मचांथ सटीक-विलाग धीजे-पांचमो छुटो कर्मचांथ.

शेठ रत्नश्च वीरश्च तथा अनुबाध नेचंदनी सहायथी.

८ श्री पंचाशक शिक्षा सटीत. ( अपूर्व अंथ )

शेठ सोआगचंद क्षुपुर्यंद लभनगरनिवासीनी सहायथी.

९ श्री पडम चरितम् ( श्री पदचरित ) भागवी गाथांध. ( सभा तरक्षथा ).

१० श्री परिशिष्ट पूर्व. भूग. श्री हेमचंद्रार्थ दृष्ट.

आखु सालेख राय भुवानेश्वर बहार तथा शेठ  
दीर्घचंद्राध दीप्यंद सी. आठ. छ. नी सहायथी.

११ श्री उपदेशप्रासाद लापांतर लाग १ लें. ( रथंब १ थी ४ )

नीचे ज्ञानवेदा अथा थोडी सुदतमां अपावा शरू थो.

१२ श्री कुवलयमाणा—शेठ रसिक ने उपदेशक गद्यअंध अरित्रिनु लापांतर.

१३ श्री उपदेशप्रासाद अंथ भूग.

१४ दानसार ( आषट्क ) शिक्षा. पन्नसुद्ध गंजीसविज्यंद दृष्ट.

नीचे ज्ञानवेदा अथा तैयार आय छे.

१५ श्री इन्द्रपथी. श्री भवयगिरिज दृष्ट शिक्षामुक्त.

१६ श्री उपमिति लवप्रपंथ लापांतर.

आ सभाना लागू भेदभावे आलु वर्षमां धब्बा अनुदृष्ट अथोनो लाल मग्वानो  
अंथ दीक्षित लालैद मेम्बर थवा धन्त्यनारे ध्यानमां राख्या योग्य छे. ते साथे आवा अ  
अथा बहार पालना भाटे सहाय आपी सुनि भद्रादान विग्रहने दानदात आपवासां पौरा  
दृष्टयो सहुपरीग दरवानुं पशु ध्यानमां राख्या योग्य छे. तेही धन्त्यवाग्ये च  
पत्रवद्वार दरवो, नेही तेस्तो धन्त्यतुसार गोउत्यु दरी आपवासां अवरो.

# श्री जैनधर्म प्रकाश.

ततः प्रसन्नहृदया गुरुवस्तेन्यो यृहस्थावस्थोचितं साहुदर्शायेष्यं च प्र-  
तिपादयन्ति धर्ममार्गं । ग्राहयन्ति तदुपार्जनेषायं महायत्नेन । यद्युत जो  
जज्ञाः सद्धर्मसाधनयोग्यत्वमात्मनोऽनिदिष्टद्विज्ञनवदिदमादौ कर्तव्यं जव-  
ति । यद्युत सेवनीया दयाद्वात् । न विधेयः परप्रस्तिवाः । मोक्षत्वा कोपनता । व-  
र्जनीयो दुर्जनसंसर्गः । विश्वितव्याविक्वादिता । अन्यसनीयो गुणानुरागः ।  
न कार्यं चैव्युच्चिः । त्यजनीयो मिथ्याजिमानः । वारणीयः परदाराज्ञ-  
क्षापः । परिहृतव्यो धनादिगर्वः । विधेया द्वुःखितद्वुःखत्राणेभा । पूजनीया  
गुरवः । वंदनीया देवसङ्ख्याः । सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः ।  
अनुवर्तनीयो मित्रवर्गः । न जापाणीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः ।  
द्वजनीयं निजगुणविकल्पनेन । स्मर्तव्यमण्डियोऽपि सुकृतं । यतितव्यं परार्थे ।  
संजापणीयः प्रथमं विशिष्टदोक्षः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेयं  
परमर्मेद्यदृष्टनं । जवितव्यं सुवेषाचारैः । ततो जविष्यति जवतो सर्वज्ञसम्मर्मानु-  
ग्रानयोग्यता । उपमितिजवप्रपञ्चा कथा ।

---

पुस्तक २६३३०. कातिक. सं.पत् १६३७. शाढे १८७२. अंक ८ मे.

---

## हिंसानिषेधक पद.

( कपुर हेये अति उज्ज्योरे—चे राग )

वहुदो छव क्लेम आपांदे, वहुदो सैने हेय;	
सुख वल्लक सहु प्राणीयारे, हुःभ वांछक नहि केयरेऽप्राणी!	
परिहर दुःखाप छिंसा नरकुनी छापरे, प्राणी! हिंसा० १	
सुखीया परहुःभ नवि लहुरे, वेदक परहुःभ बाण;	
पशु पर्खीने भीडारे, स्तने सुख न भानरे.	प्राणी० २
उलय प्रन राजतरुरि, भानव ने पशु थाय;	
न्याय भयो नरने लहोरे, पशुनो न्याय न थोयरे.	प्राणी० ३
शरहु तरहु सुख लहुरे, नासे शक्ष न यास;	

२२६

जैनधर्म प्रकाश.

शयु छतां पशु नव हुणेर, धर्म ए क्षमीना आसदे.  
 अशश्यु तरश्यु नित्य लभेर, भयमित शश न पास;  
 चुगवाडि हुणुतां थडांने, काव धर्मनो नाशदे.  
 गुलतां वे आकरी करेर, गरीने सेवे पाय;  
 पशु पाणीने वे हुणेर, ते नर नरडे जायदे.  
 यजांतर नवरानीमारे, माणीनो वध थाय;  
 मूळ छेटे इशा नव भेदे, पशु विषु देश पीडायदे.  
 जगाचर दणाचर अग तण्हीर, हिंसा न करा केय;  
 रुशम आदर अवनीर, पाणे ज्याया जेथदे.  
 धर्ममूळ लागी दयारे, पाय मूळ अलिमान;  
 सांकणचंह सै प्राणीमारे, सरभा अव समानदे.

आण्ही० ४  
 आण्ही० ५  
 आण्ही० ६  
 आण्ही० ७  
 आण्ही० ८  
 आण्ही० ९

## श्री ज्ञान सार सूत्र विवरणम् त्यागाप्टक. (c)

जैन तत्त्व शान. (Jain Philosophy)

(सेण्क सन्मित्र कपुंर विजयलु)

दत्तवयीविषु साधना, निष्ठण कही सहीव;  
 भावरथणुनु निधान छे, जय जय संयम लुव-१  
 शुद्धातम शुणुमें रमे, तलु ईद्रिय आशास;  
 यिर सभाधि संतोषमें, जय जय संयम वंश-२

ईद्रिय दमन माटे शासनारे करेवा उपदेश मुज्जन वे भव्यात्मा प्रणा पु-  
 द्यर्थवटे भन अने ईद्रिये उपर आशु भेद्ये छे, वे भन अने ईद्रिये ने रवेअग-  
 नारीपछु वर्तवा नहु देतां स्ववश वर्तावे छे, तेज अरेखर त्याग-संयमना अ-  
 पिकारी गण्याय छे, तेज त्याग-संयमने अरेखर दीपावे छे अने लक संततिनो  
 दृश्य कही अनुकमे अक्षय सुखना विवाची णने छे. ते त्याग-संयम केवा प्रकारनो  
 छे ? रोमां केवी निःस्युहुतानी ज़रूर छे ? अने रोथी केवो असाधारण लाल आत्मा  
 नेतानी शके छे ? तेनीजांगी प्रभाणिक ऐवा गीतार्थ मुझेनां पर्यावडे गन आपनी

શ્રી જ્ઞાન સાર સુન વિવરણમુખ.

૨૨૭

પ્રસ્તુત નિચારી છે. એવી ધૂદ્રિથી કે મૂળ અંધકારે ત્યાગ-સંયમ માટે કે સહૃપદેશ આપ્યો છે તેતું માહાત્મ્ય લંઘનોના હૃદયમાં વિશેરે સ્કુરાયમાન થાય આને અચચ બ્રદા-વિદેષકી ત્યાગ માર્ગ અહો તે ત્યાગ-સંયમનું પરિપાલન કરવા પ્રણામ પુરુષાર્થી દોષપના ઉદ્ઘૂરુત ણનો. રોપણો નીચે પ્રગણિ—

દેશ વિરતિને સર્વ વિરતિને, ગૃહી યતિને અલિરામ;

તે ચારિન જગત જયવંતુ, કીને તાસ પ્રણામરે, અવિકા! સિદ્ધચક્રપદ વંદો. ૩૬  
તૃબૂરેરને વદ અંડ સુણ છાંડી, ચક્રવતી પણ વરિયે;  
તે ચારિન અખય સુખ કારણુ, તેમે મનમાંદી ધરિયે રે. ૩૭

હુઅ રંડ પણ નેહ આદરી, પૂજુત ઈંહ નરિંહ;

અયરસુ ચરણ ચરણુ<sup>૧</sup> તે વંહ, પૂર્ણ સાન અમહે રે. ૩૮

બાર માસ પર્યાયે જેહને, અનુતતર સુખ અતિકમીએ;

શુક્ર શુક્ર અલિલાલ તે ઉપર, તે ચારિને નમીયે રે. ૩૯

ચય તે આડ કર્મનો સંચય, રિકિતં કરે કે તેહ;

ચારિન નામ નિર્દેશ આખ્યું, તે વંહ શુણ ગેહ રે. ૪૦

દાળ-નાણુ ચારિન તે આતમા, નિજ વલાવમાં રમતો રે;

દેશધા શુદ્ધ અલંકરી, મોહ વને નવિ લમતો રે.

વીર નિર્નિશ્વર ઉપહિશે.

## ચારિત્ર પદ્ધ પૂજા ૮ મિ

દાહરો.

ચારિન ધર્મ નમો હવે, કે કરે કર્મ નિરોધ;

ચારિન ધર્મ જસ મન વશ્યો, સક્રોં તસ અવગ્નોધ. ૧

દાળ—હેશી રંગ લાગ્યો.

ચારિન પદ નમો આડમે રે, નેહુંથી લબ જય નય; સંયમ રંગ લાગ્યો.

નૃતર સેદ છે નેહના રે, સિતેર સેદ પણ થાય.

સં૦ ૧

૧ ચારિન, ૨ આડતી,

२१८

## जैनधर्मप्रकाश.

समिति <sup>३</sup> शुभति <sup>४</sup> महावत वणी रे, दश क्षांत्यादिक <sup>५</sup> धर्म;	सं०
नाणुकारथ <sup>६</sup> विरतिअछे रे, अनोपम शमता शर्म।	सं० २
आर क्षाय क्षय उपशमे रे, सर्वविरति शुण्डकाण्ड;	सं०
संथम ढाणु असंथ्य छे रे, प्रणमो लविक रुग्नाणु।	सं० ३

## दोहरे।

उरिकेशी मुनिराज्ञेया, उपनो कुण चंडाण;  
पणु नित सुर सेवा करे, चारिन गुणु असरात। १

## दाणा २ ७ ( गीत )

संथम क्षम्ही मिले ससनेही, ध्यारा डो संथम क० ( ए २५ )	
युं समक्षित शुनठानग <sup>७</sup> वारा, आत्मसे करत भियारा डो।	सं० १
दोष ऐताणीश शुद्ध आहारा, नव कडपी उथ विहारा डो;	सं०
‘सहस तेवीस दोष रहित निहारा, आवश्यक होय वारा डो।	सं० २
परिसहु सहनादिक परकारा, ए सभ हे व्यवहारा डो;	सं०
निश्चय निज शुण्डु ठरणु उहारा, लहुत उत्तम लवपारा डो।	सं० ३
मोहादिक परभावसे न्यारा, दुग नय <sup>८</sup> संयुत सारा डो:	सं०
पद कडे एम सुषुप्तु उक्माणा, लहु शिववधु वरहुरा <sup>९</sup> डो।	सं० ४
आटलेथी प्रस्तुत प्रस्तावना आटोपी भूणा थंधमां त्याग—संथमना संबंधे ने रहस्य रहेलुं छे ते हवे लहुये।	

संयमात्मा श्रयं शुच्छोपयोग पितरं निजं ।

धृतिमंबां च पितरौ, तन्मां विष्टुजत ध्रुवं ॥ १ ॥

**शाखार्थ—**संथमने भाटे अलिमुख थेदेहे हुं शुद्ध उपचोग इपी पोताना  
पितानो अने धृति (संतोष वृत्ति) इपी स्वभातानो आश्रय करूं छुं तेथी हे भाता  
पिता। आप अने (संथम आदरवाने भाटे) निश्चय आज्ञा आप्ता !

**परभार्थ—**सांसारिक धंधनथी छूटाकरी, जन्म भरणु जन्य अनंत हुःध-

<sup>३</sup> गमनागमनादिक हियामां सम्यक् [पतना पुर्वक] प्रवर्तन  
मन वशन अने क्षयाने क्षमाविश्व रहेवा भाटे गोपनी राखवां ते। ५ क्षमा, मुहुता  
विगेदे हश प्रकारने यति धर्म ६ जानतुं कार्ये इण विरति—चारिन छे ७ समक्षित शुष्कस्था-  
नक्षमाणा ८ एक हुनरने तेवीश ९ निश्चय अने व्यवहार.

શ્રી જાનસાર સુત્ર વિવરણભૂ.

૨૮૬

તે જલાંજલી આપી, શાશ્વત સુખને ખાત્રીથી મેળવી આપનાર આત્મનિશ્ચક રૂપ સંયમ આદરવાને સંસુધ થયેલો આત્મા પેતે પોતાને સંભાધીને કહે છે કે-હેઠેથી હું મધ્ય, વિષય, કષાય, નિરા અને વિકથા રૂપ પંચ પ્રમાણને વશ પડી જે અશુદ્ધ ઉપયોગમાંજ મજન હતો તેનો ત્યાગ કરી અહિસાહિક ઉત્તમ પ્રતોમાં આદરવાળો થઈ, દ્રવ્ય ભાવથી પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ તે તે મહાવતોતું પરિપાલન કરવા માટે નિજ લક્ષ સાધવા શુદ્ધ ઉપયોગ રૂપી પરમાર્થ પિતાનોજ આશ્રય કરીશ અને પોતાની આત્મ પરિણામિમાંજ રતિ-પ્રતીતિ ધારી રાખવા રૂપ પોતાની અરી માતાતુંજ આવાબન લઈશા, તેથી અન્ય સાંસારિક માત પિતાને હું નાપણે વિન-  
પું છું કે આપ મને સુખકર સંયમ સાધવાને માટે અનુમતિ આપો.

**વિવરણ—**આ વાત અનુભવ સિદ્ધ છે કે જયાંસુધી આપણુને માસવસ્તુથી કોઈ ઉચ્ચ પવિત્ર વસ્તુતું યથાર્થ ભાન અને શ્રદ્ધાન યથું નથી લાંસુધી પ્રાસ વસ્તુમાં આપણુને લાગેલો મોહ છૂટી શકતો નથી. પણ જ્યારે કોઈ ઉચ્ચતર પવિત્ર વસ્તુતું આપણુને યથાર્થ ભાન અને પ્રતીતિ થાય છે લારે તે પવિત્ર વસ્તુ પ્રત્યે આપણુને દ્વારાએ પ્રેમ-પૂજયભાવ પ્રગટે છે અને તે પ્રગટેલો પ્રેમ-પૂજયભાવ તે પ્રત્યે આપણી અંતઃકરણની ઉપાસનાથી હિન પ્રતિહિન વધતો જાય છે. જેમ જેમ આપણો પ્રેમ આ દ્વિશામાં વધતો જાય છે તેમ તેમ પ્રથમની માયિક વસ્તુમાં લા-ગેલો આપણો મોહ એછો થતો જાય છે. જ્યારે આપણે પવિત્ર વસ્તુમાં સંપૂર્ણ પ્રેમ જગાડીને તેને લેટેલો વખત સુધી અનન્ય ભાવે લેટાયે છીએ ત્યારે તેટલા વખત સુધી અન્ય દ્વિશામાં લાગી રહેલો આપણો મોહ છૂટી જાય છે. એવી રીતે અનુદૂકે જ્યારે અક્ષાસ વિશેષથી અસાર અને અનિલ વસ્તુમાં લાગેલો પ્રેમ-મોહ સભૂગણો છૂટી જાય છે તેમજ સારભૂત અને નિય એવા પરમાત્મ તત્ત્વમાંજ પૂર્ણ પ્રેમ લગે છે ત્યારે પરમ સુખદાયક પરમાત્મ તત્ત્વ પાભવા માટે જે સત્ત સાધ-  
નો સત્ત શાસ્ત્રોમાં દ્વારા અન્યાન્ય છે તે તે સત્ત સાધનો સત્ત શાસ્ત્ર નીતિ સુનાય સેવવા આત્મા અન્યાન્ય આદર પૂર્વક ઉજમાળ થાય છે. એવે વખતે ચક્કવતીં રાજ પણ પણ પો-  
તાના સંપૂર્ણ સામ્રાજ્યને તિલાંજલિ દેટાંલાગારે વિશ્વાં કરતો નથી. તે પોતાની શુદ્ધિક કંદિને એક પલકમાં પરહરી અક્ષય કંદિ સિદ્ધિને આપનાર સંયમ કરુણાની દુલ્દિ, એ જી પ્રકાર વડે સંયમનું આરાધન થઈ શકે છે. ઉક્ત સંયમનું યથાનિધિઓ આરાધન કરવામાટે રાગ દ્રોષ અને મોહાદિક અંધનથી સહંતર હું રહેલું જો-

ज्ञाते अने तेष्टामाटे ज्ञेधी रागादिक अधन थाय तेवां कारणोद्यो खणु सहंतर अणगा  
स्तुवुं ज्ञेधये. माता, पिता, अधुओ, स्त्री आदिक स्वजन अने ज्ञाति प्रभुभ परिजनोना  
रेहु पायथमां नज पडवुं ज्ञेधये. तेथीज संयम सन्मुख थयेता आत्मा रागादिक  
अधनकारी भातपितादिक खडिर कुटुंबनो. त्याग करी एकांत हितकरुं अंतर कुटुं  
भनो आदर करवा उज्जमाण थाय छे. ते शुद्ध उपयोगरूप दृपविन पितानो. अने  
आत्म परिषुतिमां रतिदृश धृति-मातानो पोताना संयमनी रक्षा अने पुष्टि नि-  
सित निश्चय पूर्वक स्वीकार करे छे. शुद्ध उपयोगरूप लोडेतार पिता अने धृतिरूप  
अंबा संयमात्माने जन्म आपे छे. सर्व भ्रकारना अपाय—उपद्रवादिकी तेनो  
पचाव करे छे. तेनु अनेक सत्साधनेवडे पोषणु करे छे अने असंत्र प्रेम-वात्स-  
ल्यां तेनुं परिपालन करतां अंते तेने पोताना शुद्ध स्वरूपने ग्रास करावे छे. माता-  
पितादिकी अनुभति मेणवी संयम अंगीकार करी संयमात्मा ने आवो उत्तम  
भ्रकारनो स्वरूप लाल भेणवी शडे छे, ते लौकिक भातपितादिकी क्षणिक भाया तरु  
ने लोडेतार भातपिता उपर अनन्य प्रेम वात्सल्य अने श्रद्धाथीज.

मातपिताना प्रेमनो विवेक भतावी हुये णांधयेना प्रेमआशी कहे छे.

युष्याकं संगमोऽनादि, वंघवोऽनियतात्मनाम् ।

ब्रुवैकल्पान् शिलादि, वंगूनित्यवुना थ्रये ॥ ४ ॥

**शण्टार्थ—**हे अधुओ! अनिश्चित स्वभाववाणा एवा तमारो समागम  
अनादिनो छे (तेन तज्जने) हुये तो निश्चय लैकाज स्वभाववाणा एवा शीलादिक  
अधुओनोज हुं आश्रय कडुं हुं.

**परआर्थ—**भातापिता उपरांत अधुओ पण लौकिक दृष्टिकी उपगारी ग-  
ण्युय छे भाटे तेमनी अनुभति मांगवी ते पणु उचितज छे. शीलादिक सद्गुणेण  
आत्माने अरेखर एकांत उपगारी छे. तेमनो संबंध अविहुड छे. लौकिक अधुओ  
स्वार्थनिष्ठ हेवाथी तेमनो स्वभाव निश्चित होइ शडेज नहि. तेथी संयमालिभुभ  
मनुष्य तेमनो संबंध तोडीने शीलादिक साथे संबंध ज्ञेइ छे.

**विवरण—**ने प्रीति क्षणिक, स्वार्थी अने असारछेतेवी प्रीति शुद्धिवते करवा  
योग्यन नयो. ने प्रीति उपाधि रहित छे अने तेथीज ने परिषुगे अदृश्य सभर्पे  
छे तेवीज प्रीति करवा योग्य छे. लौकिक प्रीति विषभयी छे त्यारे शीलादिक सद्गुण  
साथे लोडेतार प्रीति निर्विषभयतमयी छे. लौकिक प्रीति विषभयी हेवाथी तापकारी  
हे अने तेथीज ते तजवा योग्य छे त्यारे लोडेतार प्रीति निर्विषभयतमयी हेवाथी  
शांति-शीलक्षताकारी छे अने तेथीज ते सेववा योग्य छे. लौकिक अधुओ क्षणिक कृप-

શ્રી જાતિસારસ્તુ ક વનષ્ઠથમુ.

૨૩૧

માં એકજ ભવમાં સાહાય્યકારી થાય છે ત્યારે શીલાદિક સદ્ગુણુ રૂપ લોકોત્તર બચ્ચેઓ આત્માને ભવેષત્વ સાહાય્યકારી થાય છે. દોકિક બંધુઓ. કરતાં શીલાદિક બચ્ચેઓ બનુશ્શ બંધ્યા પ્રકારની અમૃત્ય સહાય આત્માને અપી આત્મા પાસેથી તેનો લગાઈ બદલો ઈચ્છાતા નથી. એવા તે નિઃસ્વાર્થ બંધુઓ છે. તેથીજ સંયમાનિસુખ આત્મા સ્વાર્થી બંધુઓના સંબંધ મર્યાદાપૂર્વક તોડીને પૂર્ણ પ્રેમથી શીલાદિક બંધુઓને લેટાના ઉજમાળ થાય છે. એવી રીતે બંધુઓના સ્નેહનો વિચેક બતાવી શ્રી તથા જાતિના સ્નેહ આશ્રી કહે છે—

કર્ના મે સમતૈકો, જ્ઞાતયો મે સમકિયાઃ ।

વાદ્યવર્ગમિતિ ત્યક્ત્વા, ધર્મસન્યાસવાન् જનેતુ ॥ ૩ ॥

**૨૫૪દ્વાર્થ—**સમતા એજ એક મારી સાચી પ્રિયતમા છે અને સમાન ધર્મ કરણીને કરનારા સાધમી લાઇઓજ ભારે જાતિવર્ગ છે. એવી રીતે બાધ્ય કુદુંબ-ભાગને તણું સંયમાલિસુખ આત્મા ગૃહસ્થ ધર્મનો લાગ કરે.

**પરમાર્થ—**ગૃહસ્થ જેમ ગુહિણી (ખો) ના સાહુચર્યથી શોખે છે તેમ સંયમી સમતા રૂપી અધીશ શોખે છે—સુપી રહે છે. ગૃહસ્થને ગૃહબ્યવહારમાં જાતિવર્ગની જ્યાં જ્યાં અદૃ જણ્યાય છે તેમ સંયમીને સંયમ વ્યાપારમાં સંયમી એવા સાધમી જ્યનો જ્યાં લાં ડુગારી થાય છે. આવા ઉદ્ધાર અભ્યાંતર કુદુંબ વર્ગનો સદ્ગ્રિવેક્ષી સ્વીકાર કરી સંયમાલિસુખ આત્મા તેથી ઈતર બાધ્યવર્ગનો લાગ કરીને સુધે સ્વસ્થનીહિતને સાધે છે.

**વિવરણુ—**જે અર્ધાંગના ગૃહસ્થપણાતું ભૂષણ છે તેનો ત્યાગ કરનાર સંયમી સમતા અનેજ અંગેઅગે લેટે છે. ગૃહસ્થ એ જ્યારે અશુચિપૂર્ણ હેઠ ધર્મનારી વિકાર યુક્ત અને વિકારને વધારનારી છે ત્યારે સમતા એ દેહાતીત અને નિર્વિકારી હોવાથી પરમ શીતળતાને પેઢા કરનારી છે. તેમજ દોકિક જાતિજનો જ્યારે પ્રપંચ પરાયણ અને સ્વાથનિષ્ઠ જણ્યાય છે લારે લોકોત્તર જાતિ વર્ગ કેવ. એ ધર્મ પરાયણ હેઠ પરમાર્થ દૃષ્ટિવંત હોવાથી અભ્યાંત લાભકર્તા હેખાય છે. આપા મહાન તદ્દ્વાતથી સંયમી મહાશય કલેશકારી અનો પરિહાર કરી એકાંત આત્મ સમધિને કરનારી સમતા અનો સ્વીકાર કરે છે. અને પ્રપંચી જાતિવર્ગનો પરિદાર કરીને ધર્મનિષ્ઠ સાધમી જ્યનોની સંગતિ સ્વીકારે છે.

દૂરે ત્યાગની ઉચ્ચી કેટિ આશ્રી કહે છે.

ધર્મસ્તાંજ્યાઃ સુસ્ંગોત્થાઃ હ્યાયોપજામિકા અવિ ।

२३२

जैन धर्म प्रकाश.

**प्राप्य चंदनगंधाज्ञं, धर्मसंन्यासमुच्चमयु ॥ ४ ॥**

**शृणुहार्थ—**भावनायं हनना गंध लेवो उत्तम धर्मसंन्यास पाभीने सु-संगती उत्पन्न थयेला क्षयेपशमवाणा धर्म गणु त्याज्य थाय छे.

**परमार्थ—**जेम भावनायं हननो सुवास सर्वेपरी छे अने ते भावना-यां हनमां एक सरभी रीते सर्वन् व्यापी रहेलो छे ते पाभीने खील सुवासनी ग-२४ रहेती नथी तेम आत्माना दृढेक प्रदेशमां सत्तागत रहेल अनंत ज्ञानादिक धर्म ले क्षायिक लावे संपूर्ण रीते प्रगटी नीकोइतो पछी भंड क्षयेपशम भावना प्रतीत थता ज्ञानादिक शुण्डानी कंधूपणु ज़रूर रहे नहि.

**विवरण—**जेम सूर्योदय थां चांद्र, थह, नक्षत्र अने ताशनी ज्योति जिन ज़रूरनी छे अटले के ते सर्वनी ज्योति सूर्यना तेजमां समाई जाय छे तेम अनंत ज्ञानादिक प्रलक्ष अने क्षायिक धर्म प्रगट थये छते परोक्ष अने क्षयेपशमिक ज्ञानादिक्की ज़रूर रहेती नथी. मतलब के क्षयेपशमिक लाव अख्यातिक साधन इपे लारे क्षायिक लाव संपूर्ण साध्य इपे छे. कार्य कारणु भावनी ऐरे ज्यारे संपूर्ण रीत्या साध्य धर्मनी सिद्धि वर्ध वृद्धी तो पछी साधन धर्मनी ज़रूर रहेती नथी. साधन धर्म ए कारणु इपे छे अने साध्य धर्म ए कार्य इपे छे. परंतु संपूर्ण साध्य सिद्धि थाय पहेलांक वे साधनधर्मनी उपेक्षा करी तलु हे छे ते हतलाज्य उपेक्षा ब्रह्म थाय छे. तेथी सदियेकी सञ्जनो स्वसाध्य सिद्धि सुधी सत् साधनो उपयोग प्रमाण रहित कर्याज करे छे, अने ऐस करीन अंते स्वसाध्यनी सिद्धि करे छे.

तेज वाततुं शावकार दृष्टांतं वडे समर्थनं करे छे.

गुरुत्वं स्वस्य नोदेति, जिद्धा सात्म्येन यावता ।

आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुनामः ॥ ५ ॥

**शृणुहार्थ—**ज्यांसुधी पोतानी भूत पोतेज सुधारी शडे—पोतानी भूत सु-धारवा ईंटानी प्रेरणानी ज़रूर रहेज नहि ऐतुं आत्मतत्वना प्रकाशवडे-स्वरूप योधवडे पोताने शुद्धत्व (शुद्धलु) प्राप्त थाय नहि लांसुधी सुगुक्षु-सुनिये उत्तम शुद्धमहाराजनी सेवा कर्याज कर्त्त्वा.

**परमार्थ—**आत्मार्थी मुनिये सहयुद्धनां चरणु कमणीनी सेवा त्यांसुधी अ-पूर्ण अप्रगतलावे निष्काम वृत्तिथी कर्या करनी के ज्यांसुधी पोतेज ते शुद्धना अ-विन पहने प्राप्त थर्य वय.

**વિવરણ**—એમ કુશળ અને પ્રમાણિક કાર્યગર પોતે હાથ ધારેલું કામ બહુજ ઉમદા રીતે કરી આપી સામાનું હીલ પ્રસંગ કરે છે, તેમ સહાચારમાં કુશળ એવા સદગુરુ મહારાજ પણ સ્વશરણુગત શિષ્યને એવી ઉમદા શુક્તિથી પ્રગણે છે કે તેથી લભ્ય શિષ્યનું હીલ હિન પ્રતિહિન પ્રસંગતાનેજ પામે, અને તે શિષ્ય સહાચારમાં ગુસ્ત બને. પણ જે શિષ્ય સદગુરુની ડડી શિક્ષાને હીલમાં ધારે નહિ અને અર્થીરે થઈ સ્વચંહી એની જાય તો તે શિષ્ય ગુરુ લાભથી એ નશીળજ રહેલે. ને પથ્યર સૂત્રધાર ( સલાટ ) નાં ટાંકણુંને સહે તો તેમાંથી મનોહર ભૂતિ અની તે પૂજા યોગ્ય થાય, નહિ તો તે લોકેના પગ નીચે કચરાય; તેમ જે શિષ્ય સદગુરુની સુશિક્ષાને અમૃત બુદ્ધિ આદરે તો તે અંતે ગુરુપદને પામે, નહિ તો તે ઉલ્લભ બ્રાહ્ય થાય. આ અધી વાતનું ફ્રિલિત એ આવે છે કે શિષ્યે જે પોતાનું એકાંત હિત સાધવું હોય તો શુરૂને આત્માર્પણ કરીને રહેલું. મન વચન અને કાયા તેમનેજ અર્પણ કરવાં, પોતાની ધિંઢા સુજાય—સ્વેચ્છાચારીપણે, તેમાંના ડાઇનો ઉપયોગ કરવો નહિ. આથું જીચા પ્રકારનું આત્માર્પણ સહગુરુના ચરણુકમળમાં ને ને મહાનુભાવેએ કરેલું છે તે તે મહાનુભાવો ક્રીટ અમરીના દિષ્ટાંતે પોતેજ શુરુપદના અધિકારી થઈ સ્વરૂપ સાક્ષાતકારને પામી ગયા છે. માટે આત્માર્થી શિષ્યોએ એજ ( સદગુરુના ચરણું કમળ ) પ્રિકરણ શુક્તિથી ઉપાસવા યોગ્ય છે, આ અતિ અગધાની સ્વિતિથી નયું ન થવાય માટે ( સુસુકુઓએ ) ખાસ કરીને ( લક્ષમાં રાખવા ) શ્રીમાન જૈતમ સ્વામી અને મૃગાવતી સાધીના દિષ્ટાંત ભાવવા યોગ્ય છે. શાસ્કાર સમજલી ને કહે છે કે તર્ણે ફળની હિંદુ નહિ રાણતાં નિષ્કામ ( ડામના રહિત ) પણે સ્વકર્તવ્ય કર્મ કરો, તેમ કરવાથી તમે તેનું અમોદ ફળ અન્યૂક અનુભવી શકશો. પણ જે પ્રથમથી નહિ કરવા યોગ્ય એવા જોટા સ'કલ્પ વિકલ્પ કરી સ્વકર્તવ્યથી ચૂકશો તો તમે ઈષ્ટ ફળને પામી શકશો નહિ. એજ વાતનું પ્રતિપાદન કરતાં થાયકાર કહે છે:—

જ્ઞાનાચારાદ્યોઽવીધા:, શુદ્ધ સ્વસ્વપદાવધિ ।  
નિર્વિકલ્પે પુનસ્ત્વાગે, ન વિકલ્પો ન વા ક્રિયા ॥ ૬ ॥

**શાખાર્થી**—શુદ્ધ સ્વસ્વપદ ( શુષુ સ્થાનકની હંડ ) સુધી જ્ઞાનાચાર પ્રમુખ આચાર ઈષ્ટ છે એટલે તે અવશ્ય કર્તાંય રૂપજ છે. ( એમ કરતાં કરતાં અનુફરે અભ્યાસની પ્રણામતાથી ) જ્યારે નિર્વિકલ્પ લાગ રૂપ અસ'ગ યોગની આભિ થશે આરે વિકલ્પ અને કુદ્યા બંને છુટી જશે.

પરમાર્થ અને વિવરણ—સંગીનપણે આત્મહિત સાધવા ધર્યનારે પ્રથમ

२४४

जैन धर्म प्रकाश.

गियामतिने तजवा मार्गिनुसारीगां (शियागां) गाहगानी गूरेपूरी जड़र छे. तेमां पणु न्याय संपन्न विलक्ष, वडील सेवा, विनय अने कुपाय त्याग एटवा उपरतो बहुज लक्ष राखवानी जड़र छे. वगा हेव गुरु अने धर्मनी निविध रीते (सूर्यम लुद्धिथी) परीक्षा करी के सत्य अने शुद्ध तरो नीको तेज आहरवानी अने तेतुज आण्ड आराधन उरवानी जड़र छे. अहों सुधी चतुर्थ शुणुस्थानकनी हड गण्याय छे. तेमां शुद्ध हेव गुरु अने धर्मनी हरेक रीते मूळ प्रखावना करवा अने तेमां काणहेखाटिकी थांती गलीनता टापावा पोतानाथी अने तेटवो. पुढ्यार्थ झारववो अे पोतानुं मुख्य कर्तव्य गण्याय छे. के कार्य पोताना अधिकार बाहारनुं छेवाथी अनी शेंडे अंतु न छेव ते कार्य के अधिकारी जनो इरी शेंडे तेम छेव तेमने पोतानाथी अना शेंडे तेटवी अने तंती सहानुभूति (सहाय) आपवी अे पणु घालुंज अगस्तुं कर्तव्य छे. तेमज नीचला शुणुस्थानक वाजाअे उपका शुणुस्थानके जवा माटे भावना सह अल्यास घणु अवश्य कर्तव्य छे. पांचमे शुणुस्थानके ज्ञान (समज) पूर्वक स्थूल प्राण्यातिपात विरभाष विगेरे (हिंसा व्यागादि) वरो अंगीकार करी काणलुथी पाणानी जड़र छे. तेमज शर्वथा हिंसा व्याग-अहिंसाटिक महावरोनी भावना सह ते माटे अनतो अल्यास कर्तव्य छे. छेंडे शुणुस्थानके सर्वे महावरों सहगुरु सभीपे समजपूर्वक आहरी तेमनुं यथार्थ रीते-हृष्यक रिहत परिपालन करवा काणलु राखवानी जड़र छे. तेमज अप्रभात दशानी भावना सह अल्यास कर्तव्य छे. अम उत्तरोत्तर समझु. शुणुस्थानक कुमारेऽप अंथमां आ बाणात विशेष स्पष्टता उरेवी छे. आंथी ते संपूर्ण अधिकार विशेषरूपी जनोअे अवगाही लेवा येाय छे. तेमां प्रभात शुणुस्थानक सुधी आवश्यक अगुण कुदा अवश्य कर्तव्य उपेन्द्रियावी छे, अने तेनी कोऽप रीते उपेक्षा उरनारने भियामति कहो छे. आवी रीते शुणुस्थानकां फ्रेम समज पूर्वक स्वकर्तव्य कर्म करवामां परायण रहें तां अवश्य परभापद प्राप्त धाव छे. ते वात शास्त्रार जणुये छे—

योगसंन्यासातस्त्वामी, योगानव्यसिद्धांस्त्यगेत् ।

इत्येवं निर्गुणं ग्रन्थं, परोक्तमुपपद्यते ॥ ७ ॥

**शष्ठार्थ—**त्यागी—अंथमी पुढ्य अगुणमे अन वग्नन अने कायाने संकेलीने तजवात्य समस्त व्यापारीने तजु हे छे अने शेवी रीते निर्गुण अवश्यने पारी अन्य दर्शनाच्या लेने निर्गुण व्याह कहीने शोलावे छे शेवा अरमात्म खहने पामे छे. पूर्वमार्थ अने विवरण—ज्ञेम ज्ञेम आतेदा व्यसंयसमां सुदृढ अनतो

શ્રી માનસાર સૂત્ર વિવરણું.

૨૩૫

ભય છે તેમ તેમ સત્ત ચારિત્ર યોગે તેની આશ્રમ કરણી એાછી થાય છે, તેથી નવીન ડર્મનું આવાગમન થતું એટકે છે અને બાધ અસ્થયંતર ઉલ્લભ તપની સહાયથી પુરાતન ડર્મનું શાટન કરવાનને આત્માની નિર્મજનતા થાય છે. એટલે જે ચારિત્ર કરણી પ્રયત્ન સાધ્ય હતી તે સહજ બની રહે છે આત્માના સ્વાભાવિક ગુણોમાં સ્થિરતા જામે છે અને તે ગુણો પૂર્ણ પણું વકાસને પામે છે તેથી નિર્ઝિય અવસ્થા પામી એટલે ગુણુસ્થાન કુમારેણું કંડેલા કુમથી યોગને નિરોધ કરી, આત્મા અવિયળ પદ્ધતીને પામે છે. તેજ વાતને દિયાંત દ્વારા સમર્થન કરતાં શાસ્કાર જખાવે છે

વસુતુસ્તુ ગુણૈ: પુર્ણ-મન્તેજ્ઞસિતે સ્વતઃ ।

રૂપં ત્યક્તવાત્મનઃ સાથો-નિર્ગ્રસ્ય વિશોસ્વિ ॥૭ ॥

**શાખદાર્થ**—સાંપૂર્ણ લાગી સંદર્ભમાં સાધુતું સ્વરૂપ નિર્મળ-નિરાવરણ ચાંદ્રની પેરે ત્વાલાવિક રીતેનું અનંત ગુણોનાં પૂર્ણું સ્વતઃ પ્રગટે છે.

**પરમાર્થ**—સમસ્ત પ્રમાદરૂપ વિલાલ ઉપયોગના પરિહારથી અને અપ્રમસ્તા રૂપી અતિ ઉચ્ચ શિખર ઉપર સ્થિતિ કરવાથી નિયાંથ સુનિરાજ સાંપૂર્ણ વિવેકના ખોલ્સા સમસ્ત કર્મ આવરણુંનો સર્વર્થા ક્ષય કરીને અનંત ગુણ જ્યોતિથી યોગિત્વાન નિર્જલાંક નિર્જસ્વરૂપ ચાંદ્રને પૂર્ણપણું નિર્ણાળે છે.

**વિવરણું**—નેમ મારીના થરણી તુંબડું પાણીમાં દુણી છેક તળીયેનાય છે તેમ ડર્મના ઘાટા આવરણુથી આત્મા પણું અધેરેણતિને પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, યોગ (મન, વચન અને કથાની ચપળ પ્રવૃત્તિ) અને કથાય એ કર્મ ણાંધનનાં સુખ્ય હેઠુંઓ છે. નેમ નેમ નેમનું નેર માંહ પાડવા પ્રયત્ન સેવવામાં આવે છે તેમ તેમ આત્મા ડર્મના ભારણી હળવો થનો જાય છે, અને નેમ નેમ આત્મા હળવો થતો જાય છે તેમ તેમ તે એક કથાય છે તે એક કથાય એ શરીરાદિક ઉપાધિનો સાંખ્ય રાખનો નથી પરંતુ તેજ કણ્ણો શરીરનો અન લૂલોાક ઉપર લાગ કરીને તે તુંણાની પેરે લોકાચ સ્થિતિ લાને છે, અને એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર ણીરાજમાન થઈ જાય છે. નેમ અન તુંબડાનું દ્રાગાત દીધું તેવીજ રીતે એરંડ ણીજ, આયમુક્ત તીર અને કુમના દિયાંતથી પણ સાંપૂર્ણ રીતે કર્મથી મુક્તા થયેલા સિદ્ધ જીવોની ઉર્ધ્વ ગતિ નિર્દ્વિષય શકે છે. સકળ સિદ્ધ જીવોની સ્થિતિ ગુણુસ્થાનક કુમારેણ તથા પ્રથમ રૂપ પર્મુણ ચંદ્રોમાં સારી રોતે પ્રતિપાહિત કરેલી છે. ત્યાંથી વિશોધ રૂપી જ્ઞાનોચ્ચે અવગાહી લેવા અધ્ય કરવો, ઉપર શ્રીલોકમાંખતાવેલું ચંદ્રમાનું

૨૩૬

જૈત ધર્મ પ્રકાશ

દ્વારાંત તો સુપ્રસિદ્ધ છે. જેમ સમર્પણ અભયથી સુકૃત થયેલો ચંદ્ર સકળ કળાથી ‘ચંદ્રપૂર્ણ’ ખીલી નીડળે છે તેમ સમર્પણ કર્મ આવરણુથી સુકૃત થયેલા આત્માઓએ પણ અનાંત શુદ્ધ સમુદ્દરાયથી પરિપર્ણ હીપી નીડળે છે. સુખ્યગણુ આ સ્થિતિનો સાક્ષાત્કાર કરવાના અધિકારી લટુ ચારિત્ર પાત્ર સાધુઓએ છે. ઈલ્લામણ.

### જ્ઞાવ ધર્મ.

અનુસંધાન ગૃહ (૨૦૮) ધી.

ચંદ્રોદાર નૃપ કથા ચાલુ.

આ પ્રમાણે નહે મિત્રોને સદા સર્તોષ પમાડતો મંત્રી ઉદ્ઘાસન રાજના શાસનમાં ચિરકાળ સુધી આનંદમાં રહ્યો. એકદા નિય મિત્રની સાથે એક શાયામાં રહેલો ઘણું ભૂષણુદાળો તે મંત્રી સુણે સુતો હતો. પછી જ્યારે તેણે નિદ્રાનો લાગ કર્યો લારે તેણે પોતાની પાસે શ્યામ વર્ણના, રક્ત નેત્રવાળા અને જાણે ગર્વને ત્રોદી પાડનારા સુદ્ધగર હોય તેવા ઘણું હૂર માણુસોને હલેલા જ્યાયા. તેમને જેઈને લય જીવની મંત્રીએ પૂર્ણું કે—“તમે ડોધ પામેલા સ્વામીની આજા પાળનારા છો તેણો કહો કે તમે અતે ડેમ આંધ્રા છો ? મારામાં શો આપરાધ આવ્યો છે ? અને સ્વામીની શી આજા છે ? ” ત્યારે તેઓ જોલ્યા કે—“તમારા હોષને તો સ્વામીજ જાણે છે, પરંતુ તેમની આજાથી તમને મંત્રીપણુના અધિકારથી હૂર કરવામાં આંધ્રા છે અને તમને આનેજ કુવામાં નાંખવાના છે.” આ પ્રમાણેનું તેમનું ‘વાક્ય સાંભળીને લય સમૂહથી વ્યાઙ્જા થયેલા સચિને મંદપણુને લીધે શુદ્ધ વાણી વડે નિત્યમિત્રને કહ્યું કે—“હે મિત્ર ! હે મિત્ર ! હલો થા. ડોધ પણ રીતે મારું રક્ષણુ કર. આજે મારાપર ઉદ્ઘાસન રાજ ડોધાયામાન થયો છે. સંપત્તિને વખતે પ્રાણીએને લોલી એવા મિત્રો કયા નથી હોતા ? ( ઘણું હોય છે. ) પરંતુ જે વિપત્તિને વિષે પણ મિત્રપણે દેખાય છે, તેવાથીજ આ ગુઢ્યી રતનજનની કહેવાય છે. હે મિત્ર ! પિતા, માતા, પ્રિયા, પ્રાતા અને સુતાહિક કરતાં પણ તું મને અધિક પ્રિય છે. ડેમકે લોડો હુંણના ઉદ્ઘારને માટેજ સન્મિત્ર કરે છે, તેં આજે આ રાજથી કષ્ટ પામેલા એવા મને આ અસર હુંણ સાગરમાંથી તારવા માટે તું વહાણ કૃપ થા. ” આ પ્રમાણેના મંત્રીના શુદ્ધ વચ્ચેનો સાંભળીને રતન સુખવાળો નિત્યમિત્ર જોલ્યો કે—“ અરે ! તારાપર રાજ ડોધ પામેલા છે, તે વાત મને શા માટે હું છે ? આપણું એનો ( મારે અને તારે ) શો સંણંધ છે ? ” તે સાંભળીને ‘શુ’

બાળ ધર્મ.

૨૩૭

આ મને એણાખતોજ નથી ? એવી આંતિકી શુદ્ધભૂદ્ધિ ગોલયો કે—“હે મિત્ર ! તારા ચિત્તમાં બ્રમ થયો છે કે શું ? શું તું મને એણાખતોજ નથી ? ” નિત્ય-મિત્ર ગોલયો કે—“ હા, મેં તને એણાખ્યો, તેં રાજવિરુદ્ધ કંઈ કાર્ય કર્યું છે, અને તેથી ન્યાયવંત ઉચ્ચશાસન રાન્નાં તારો નિયાં કર્યો છે, તેથી રાજવિરોધી એવા તાડું મારે કંઈ કામ નથી, ન્યાયની રીતે કહીએ તો તે કરેલા કાર્યના ફળરૂપ નિયાં તું એકલોજ જાહેર કર. ” શુદ્ધભૂદ્ધિ ગોલયો કે—“હે મિત્ર ! મેં નિરંતર તારે વાસ્તોજ અકાર્ય કર્યું છે, અને તારાપરજ ઉપકાર કર્યો છે, અરે ! તે સર્વે ઉપકારને તું ભૂલી ગયો ? ” તે સાંકણીને અત્યંત વિધુર થયેલો નિત્યમિત્ર હોધધી ગોલયો કે “ના, ના, હે નિર્લંજ ! શું ણણે છે મારે માટે તેં શું કર્યું છે ? જેમ જેમ હું તાડું આપેલું આતો, તેમ તેમ તું પ્રસાદ થતો હતો; તેથી તેં તારે માટે જ બધું કર્યું છે, કંઈ મારે માટે કર્યું નથી. હે મિથ્યાલાખી ! રાજ સાથે વિરોધ કર-નારા એવા તાડું મારે કંઈ પણ પ્રયોગન નથી, માટે તું માડું પડણું સુધી હે. ” એ રીતે તેનો તિરસ્કાર કરીને ઉલટો તે તો તેને ગળે પડ્યો.

ઉચ્ચશાસન રાન્નાં રૂઘેલા શુદ્ધભૂદ્ધિને સાંકળીને તેનો પર્વમિત્ર તત્કાળ ત્યાં આવ્યો. નિત્યમિત્રની નિરાશ થયેલા અને ‘હું મારે શું કરવું ? ’ તેવા વિચારની મૂઠ બનેલા શુદ્ધભૂદ્ધિએ જગઠી લીનાયેલા દીન ચક્ષુવડે પર્વમિત્ર સામું જેથું એટલે તેણે કહ્યું કે “હે મિત્ર ! તને શું થયું છે ? માડું સર્વસ્વ આપીને અયના તારા હુઃઅમાં મને નાંણીને કેઈ પણ પ્રકારે તું છૂટ. ” સચિવનું હુઃઅ જેઠને જેના ભને નેત્રોમાંથી જગઠારા વહેણી હતી એવા પર્વમિત્રની આવી વાહી સાંકળીને શુદ્ધમતિ મનમાં વિચાર કરવા લાગ્યો કે—“ મને વિષ્ણાર છે કે મેં મુંદળ દ્રવ્યનો વ્યય કરીને પુરુષાશ્રય (નિત્યમિત્ર) તું નિરંતર પોષણ કરું, અને આ કૃતજ્ઞ (પર્વમિત્ર) તું કવચિતજ્ઞ પોષણ કરું. ” આ પ્રમાણે તે વિચારતો હતો, તેવામાંા તો નિત્યમિત્રે તે શુદ્ધમતિને પકડીને તત્કાળ પોતાંથી જૂદો કર્યો. તે વખતે ‘અરે ! એને ન લઈ જાઓ, એને બદલે મને લઈ જાઓ, એમ પર્વમિત્રે વારંવાર આફંડ કર્યો છતાં પણ રાજસેવકોએ તો તે શુદ્ધભૂદ્ધિનેજ પકડી લીધ્યો. પછી રાજસેવકોએ તેને જેણથી જેણ્યો, તે વખતે પર્વમિત્રને અત્યંત હુઃઅ લાગ્યું અને નિત્યમિત્ર તો કન્યાના લાખ કરીને સ્વરસ્થ થયેલાની જેમ ચિરકળની નિદ્રામાં સુતો.

પછી રાજસેવકો શુદ્ધભૂદ્ધિને ખાર સૂર્યની કંતિના સમૂહજેવા, ઉચ્ચ અભિએ કરીને જેનો મધ્યલાગ દેહીખુમાન છે એવા કૂપની પાસે લઈ ગયા. તે વખતે

“ अरे दे ! आ कूपमां भने आ हृष्टचित्तवाणा सेवको नाणी देशे, तो तेमां भारी शी हशा थेयो ? ” ऐम धारी कंपायमान धयेला ते शुद्धभुद्धिने विचार थेयो के :- भने विश्विते कहुं छतुं के-ज्यारे तुं हुःणमां परीथ, त्यारे सिद्ध सर्वगानी लोकनाथ ताढ़ूँ रक्षणु करशे. आने भने तेयो अति लयंकर हुए काण मास थेयो छे, माटे हुवे तो ते श्रीमान दयासागर (प्रणुभमित्र)तुंज भने शरणु थाएयो. ” आ प्रभाणे ते विचार करे छे तेवामांकुतेखु देहीयमान सुंदर तेजवाणा अने भगुणावान उटलाक खुरपोने उत्तर दिशामांथी आवता जेया. ते खुरपोये पोताना कृश उदरसे धांधेला हता, हीरना वस्त्रे पहेरेलां हुतां, येत वज्रमय हाँडा धारणु इरवाची तेमना हाथ उच देखाता हता, तेमनां हृष्य अति विशाण (गणेशां) हुतां, नेत्रो प्रकुवित हुतां, शरीरो दीप्तिमान हुतां, तथा तेयोना मस्तकना केशो मुकुटाकणनी माणाएयोथी अलंकृत हुता. ते खुरपोये पोता राजसेवकोने कहुं के “ अरे महोन्मचो ! आ शुद्धभुद्धिने झूकी हो, आथवा आयुधने धारणु करो. ” ते सांलग्नीने ते राजसेवको शुद्ध इरवा तेयार थया. पछी तेयोनुं अत्यंत उडाएकी धूणयी अंधकारवाणुं अने जगतज्ञनोना वित्तने कंपावनाढ़ूँ मोटुं शुद्ध धूणु. तेअं ते भगुणपुरपोये उचे रहेला लोकेना देखतां कठणु आधुष्ववाणा ते राजपुरपोने अलंकृत प्रहारो कर्या, व्रास पमाल्यो, पाडी नांण्या, चुंदी नांण्या, परान्त इरु कर्या, अने छेवटे भारी नांण्या. पछी तेयोये विजयनृत्य कर्यु. लार पछी ‘ तगारो प्रणुभमित्र लोकनाथ तमने गोलावे छे ’ ऐम कहुने तेयो ते शुद्धभुद्धिने हाथवडे कुवामांथी अहार काढी साथे लाईने चाल्या.

तेमनी साथे आलतां आनंद पामेला शुद्धभुद्धिये विवेक सहित दृष्टिए जेतां ऐक महान् आलय जेयुः. ते प्राप्तादाना शिखर आकाश सुधी पहेलेला हता, तेना सर्व विलागो अनुपम उद्वासवाणा इवायाखुकारी अनेसुंदर हता, तेना शिखर उपर मुकुटावलीनुं वलय वीटेहुं होवाथी ते आलय अति सुंदर लागतुं हुतुं, पोतानी विशाणताए करीने तेखु भधी दिशाएना धेणु आण पूर्ण कर्यो हुतो, तथा अर्थ्यो, रथ्यो, अने हस्तिए वडे तेहुं आंगणुं शेवतुं हुतुं. ते आलयमां अति हर्ष पूर्वक शुद्धभुद्धिये प्रवेश कर्यो, तो त्या डेई डेकाणु भूग सरणा नेववाणी स्त्रीमोना शृंगारे करीने नेवने उत्सव थतो हतो, डेई डेकाणु गीत रुपी अभूतनी नदीने उत्तरवा माटे कर्णुनी चपणता थती हुती, डेई डेकाणु मोटा उवानेनी सुगंधीथी नासिकाने उद्वास थतो हतो, डेई डेकाणु सेंकडो जातिना उत्तम लोजनो जेवाथी जिहूवानो अबकाग

ચંચળ થતો હતો, અને કોઈ ડેકાણું કીડા સરોવરના વાયુએ કરીને આજું શરીર રોમાંચિત થતું હતું. તે આલયમાં તેણે ભાગ્યશાળીને પણ હુર્દલ એ. વાં ચાર પાયા વડે ચુક્લ અને સર્વ જનને સ્પૃહા કરવા લાયક મોટા આસન-પર એવેદા તથા વિશ્વહિતના ઉત્સંગનો આશ્રય કરવાથી અલ્યાંત સ્થિર થયેલા દીમ અંગવાળા લોકનાથ નામના પોતાના પ્રણામભિન્નને દીકા. તે મિત્રની ફરતું આરતીની જેમ સૂર્યમંડળ ફરતું હતું, તેની સમીપે રહેલો ચંદ્ર ફૂર્ણાંશ શોલિત રૂપાના અંધ્યાનની જેવો લાગતો હતો, તેની ફરતા ફેલા. થેલા તારાએ માંગળિકને માટે નાંખેલા અક્ષતના સમૂહ જેવા લાગતા હતા, મરેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્ર હથે પુર્વક તેને પ્રણામ કરતા હતા, સર્વ ધર્મના આચારીની પોતપોતાની બુદ્ધિ પ્રમાણે તેની સ્તુતિ કરતા હતા, અને તે પોતાના સેવકો ઉપર રૂપાથી નિર્મણ એવી દાખિ નાંખતા હતા.

આ પ્રમાણે નોઈને વિસ્તય પામેલો શુદ્ધભુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે “મારા ઉચ્ચિતપથને વિકાર છે કે મેં નિત્યભિન્નને મારું સર્વસ્વ આપી હીધું, અને આને કાંઈપણ સત્કાર કર્યો નહીં. કદાચ મેં વિશ્વહિતના વચનથી આને નમસ્કાર પણ ન કર્યો હોત, તો અનેક ભનોર્ય કરીને સુકલ પૃથ્વીપર ફરતાં મારી શી ગતિ થાત ?” આ પ્રમાણે ચિંતાથી જેણું ચિંત આર્ત થયું છે, એવા તે શુદ્ધભુદ્ધિએ લોકનાથને નમસ્કાર કર્યો, એટલે હર્ષે કરીને આધીન થયેલા તે લોકનાથ તેને આલિંગન કરીને પોતાના ઉત્સંગમાં બેસાડ્યો. પછી ‘હે મિત્ર ! તું આકુળ ઠાકુળ કેમ હેખાય છે ?’ એમ તે મહાત્માએ પુછ્યું. એટલે શુદ્ધભુદ્ધિએ ઉચ્ચશાસન રાજાથી પ્રાસ થયેલો લય કહી બતાવ્યો. તે સાંભાળીને લોકનાથ મહાત્માએ કહું કે—“મારે આશરે અવેલા એવા તારે હવે શો લય છે ? તે ઉચ્ચશાસન મારી પાસે કોણું માત્ર છે ? તેના મસ્તક પર હુંઘ અને સુખમાં ધૂળ પડી. વળી ‘મેં આનો કાંઈપણ સત્કાર કર્યો નહીં’, એમ ધારીને તારે લેશ પણ શોક કરવો નહીં, કેમકે સર્વ પ્રકારના સત્કાર કરતાં નમસ્કાર રૂપ્ય સત્કાર મોટો છે. રાજા પોતાના સેવકોને લક્ષ્મી આપવાથી તેમના શ્રોયાદિક (કાર્ય) નો અનૃણી થાય છે, પરંતુ તે સેવકોએ કરેલા પ્રણામનો તે (રાજા) કોઈપણ પ્રકારે અનૃણી થતો નથી. માટે પણ લોકના સાગ્રાજ્ય કરતાં પણ અધિક સ્થાન આપ્યા વિના હું તારા કરેલા નમસ્કારનો અનૃણી થઈશ નહીં. હે કુશળ ! જ્યાંસુધી હું તને આ તારા ઝણુનો લેશ માત્ર આપું ત્યાંસુધી હું અહીં

“तारी पासे रहे, अहीं तुं कोईथी पण् थय पाभीश नहीं।” एम कहीने ते बो-  
इनाथे तेने ते आलयनी उपरनी लूमिपर अडाव्यो, त्यां ते धर्मानुसार पूर्ण  
भनोरथ वाणो थधने सुणे रहेवा लाग्यो।

ए प्रभाणु केटवेक काण सुणमां व्यतित थया पणी एकढा लोकनाथे शुद्ध-  
युद्धने कहुं के “अहीं चिरकाण रहेवाथी उथशासनना सेवकोचे तने जाण्यो छे।  
हुष्ट चेष्टावाणा ए शत्रुओ, कहाय मारी सम्यग् द्रिने छेतरीने तने छांथी पक-  
डी लेशे, माटे हे भिन्न! तने एवे डेक्षे मुकुं के ज्यां तारी सन्मुण जेवाने पण्  
तेओ, कोई प्रकारे समर्थ थाय नहीं, परंतु तेट्ये हळ जनारा माणुसोने खुहु हळ-  
दायी मार्ग आवे छे, अने ते क्षुधा तुषाढिक महा हळेने सहन करवाथीज ७-  
८वंची शकाय छे, माटे हे कुशण! गाठ कलेश सहन करवामां भनने द्रढ कर, मारी  
पाण्या चाल, अने शत्रुओना कंठपीठ पर पग मुक, मार्गमां पगवे पगवे शत्रुओ  
स्नेह णातावीने मनोहर लोकनाटिवडे लोक भमारी तने गोलावशे, परंतु जे तुं  
मन, वयन के कायाए करीने तेमनी किचित् पणु संलावनाकरीश, तो तेओ, तने ते  
भीपथी पकडी जशे, ते वर्षते हुं ताइ रक्षणु करीश नहीं।” आ प्रभाणु तेने उपदेश  
प्राप्तिने लोकनाथ ते मार्ग चाल्या, अने द्रढ निक्षयवाणो शुद्धयुद्ध पण् हुर्षथी  
सिवनी पाण्या चाल्यो।

मार्गमां ज्यां ज्यां विषम रथणे शुद्धयुद्ध तृपातुर थतो, त्यां त्यां “आवो,  
शीतण जप भीओ,” एम योक्ती, जाणु श्रृंगारनी देवीओज छोय तेवी अने हे-  
दीप्यमान छाराढिक अकांक्षारथी शोक्ती पाण्याना परथने पालन करनारी ओष्ठ या-  
क्षिक्योने ते जेतो हुतो, परंतु अथिक सगृहना गणो, पडवारी व्यथा पामेवा अने  
धुष्टथी छवाएवा तुषु अने खणु (सी समूह) ने विषे तेनी द्रष्टि चमान पडती  
हती, ज्यां ज्यां ते क्षुधाए करीने हुर्षव फुक्षिवाणो थतो हुतो, त्यां त्यां तेनी चारी-  
पेक्ष पटरसवाणा लोकनाथी लारपूर तेयार पायेनी श्रेष्ठीने जेतो हुतो, परंतु  
पांथयमूहने जेहथी वयेवा स्वेतज्ञारथी व्याप्त केवा रज समूहने विषे अने ते आहु-  
रने विषे समद्रष्टिवाणो वयो हुतो, ज्यां ज्यां ते सुर्यनी कांतिना तापे करीने आ-  
उण आकुण थतो हुतो, त्यां त्यां नक्षत्रमान जेता उपेण उपेण भ्रमण्यो गायन करी  
रक्षा ले येवा छायातुद्योने ते जेतो हुतो परंतु ज्यां ज्यांमान ज्यवाणवाणा दाला-  
नाणने विषे ज्ञाने विशाण ओवा ते वृक्षसमूहने विषे तेनी हुष्टि रक्षान रक्षवाणी  
करीनी हुती, ते वृक्षेना रक्षक भतुष्यो, डोमज वाणीयी देवे योलावता हुता, तो  
पण् ते सहज चक्र भान पण् तेनापर नांणतो नहीं, आ प्रभाणु अहुषु करेली प्र-

તિજાને પૂર્વી રીતે પાળનાર શુદ્ધમતિએ સતત્વર ગમન કરતાં પોતાની સંસુપ આંદોલિક આકારવાળું, ડેવણ ર્ઝિટિક્ટુંજ બનેલું અને નિર્બાળી કે ભાગ્યશાળીએ પૂર્વે કહી નહીં જેચેલું એવું લોકનાથે ખતાવેલું એક મોટું ગુહુ જેલું. તે ગુહ જેઠનેજ શુદ્ધયુદ્ધિલું હૃદય પરમાનાંદમાં ભજે થઈ ગયું, અને તે ચડી તથા ધન્દરની સંપદને પણ તુલ્ય સમાન ગણવા લાગ્યો. તે અવસરે “જેમાં તને કોઈનો ભય નથી એવા આ મહાપ્રાસાદમાં તું તત્કાણ પ્રવેશ કર.” એમ શુદ્ધયુદ્ધિને કહીને લોકનાથ અન્ય લોકોની ધિષ્ણિદ્ધિને માટે લાંથી પાછા વણ્ણા.

આ પ્રમાણેની વણુ મિત્રો સંબંધી કથા કહીને ચારણુ મુનિ બોલ્યા કે—‘હે રામ રાજ ! સર્વ ઈષ્ટને આપનાર અને સર્વ કષ્ટને દૂર કરનાર એવા તે પૂજય લોકનાથને તું પણ મિત્ર કર અને શોક દુઃખનો લાગ કર. દુઃખ ધારણુ કરવાથી કદમ્પિ ધિચિતની પ્રાસિ થતી નથી. તેથી જે ધિષ્ટાર્થની સિદ્ધિ કરવી હોય તો તું જલદીશી તે લોકનાથનું આરાધન કર.’ આ પ્રમાણેના મુનિના વચન સાંસારિને પૃથ્વીપતિએ તેમને પૂછ્યું કે ‘હે પૂજય ! તે લોકનાથ કોણું છે ? અને તેનું આરાધન શી રીતે ધાર્ય ? તે આપ ખતાવો. હું મારી પ્રિયા સહિત તેનું અવસ્થય આરાધન કરીશ.’ વિદ્યારથ મુનિ બોલ્યા કે—“હે રાજ ! આ કથાને આંતર યુદ્ધિશી વિચાર એટલે તેનું સ્વરૂપ તારા સમજવામાં આવશે.”

આ સંસારજ અધાર એવું દૂરપાર નામતું નગર છે. તેમાં ઉથ કર્મના પરિખ્યામ રૂપ ઉભ્રશાસ્ન નામનો રાજ છે. શુદ્ધ સ્વરૂપ લાગા જીવને તે રાજનો શુદ્ધમતિ નામનો મંત્રી કહેલો છે. તે મંત્રીનો પૂર્વે કહેલા ગુણવાળો નિર્યામન તે રેનું શરીર જાણું. તેનો પવિત્ર તે તેના સગા સંબંધિં જાણું. વિશેષિત નામનો પૂજય પુરૂષ તે જુરનો ઉપદેશ જાણું. હે રાજ ! તેની શિક્ષાથી તેણું કે પ્રગામિન કર્યો તે લોકનાથ નામનો અદ્ભુત સામર્થ્યવાનું ધર્મ જાણું. તે મંત્રીએ સુઈન હક્કા પણી કે કૂર માણુસો જેવા, તે વ્યાધિ, મૃત્યુ અને હર્ગતિના કારણુભૂત એવા હુંકર્ના સમૂહ જાણવા. તેઓએ રૂઘેલા શરીરને જેઠને તેના પર પોતે કે ઉપકાર કરેલો તેને ભસમાં ધૂત નાણ્યાની કેમ નિષ્ઠા માન્યો. કોઈ કોઈ વખત પોતાના સ્વરૂપનો કાંઈ કાંઈ આપ્યું હતું, તેથી તે વણતે તેઓ દુઃખાર્થ થઈને તેની પાછળ દોષા, એટલું તેણે કીક માન્યું. સ્વરૂપનો શોકથી આકંદ કરતા રહ્યા, શરીરે રેને ગળે જાલીને અણાર કાઢ્યો અને કર્મપરિખ્યામ રાજના સેવકોએ તેને દુઃખ

इपी अविनवाणा नरक ३५ कूवामां नांगथे. पटी ‘लोकनाथ मारूँ शरणु हो।’ ऐम ल्यारे तेहुं कहुं लारे के पुड्यो आव्या ते धर्मना साक्षीभूत उर्मसमूह (सत्कर्ते) व्याख्या. हुक्कमीने छत्तीने सत्कर्ते ते छवने नयां लध गया, ते धर्मना विवेक नामना आवि निर्गण लीलावाणा (कुठा प्रासाद) व्यष्टुतो. लां तेहुं ढाना, शीत, तप अने लाव नामना चार पाया वाणा उपशम नामना आसन उपर शुद्धना उपदेश ३५ आश्रयवाणा (तेना जोणामां जेडेला) धर्मने जेयो. ते छवने श्रीमान धर्मे उत्काळ काळ सुधी पौताना प्रासादना उपका लागमां देवगतिने विषे सम्यग् दृष्टिपछु धण्डा सुभामां राज्येया. पटी शिक्षा आपका वडे स्थिर करेला अने मार्गमां विषयेथी नहीं लेलाता एवा तेने धर्मे सर्व लय रहित एवा मुक्तिरूप मांदिरमां घेऊचाउयो. हे राज ! प्रश्नाम माने करीनेज प्रसन्न थयेला जेहुं (धर्मे) आटहुं अद्युं कर्युं ते धर्मतुं विधि पूर्वक आराधन कर्युं होय तो ते शुं शुं न आपे ? ”

ते सांखणीने धर्मकिया कूवामां प्रकुलित मनवाणी राज जोव्यो के—“ हे पूत्र ! यिया सहित मने धर्मतुं आराधन कूवानी शिक्षा आपे ” लारे ते मुनीन्द्र शमतारूप अभृतसागरना तरंगोना जिठु समृद्ध केवा अक्षरैये करीने ते राजने सम्यग्धर्मनो विधिक्कडेवा लाग्या के—“ हे राज ! ते धर्मरूप हेहना पांच ईद्रिये केवा अर्हत, सिद्ध, आचार्य, उपाध्याय अने साहु जेवी रीते प्रसन्न थय तेम तुं क२. हे भूपति ! सुणे करीने साधी शाकाय अने विधननो लेश पछु केमां संखये नहि एवा ते पांच परमेष्ठिनी ग्रीतिना मुण्य उपायने हुं कहुं छुं ते सांखण—जग, अग्नि अने विषतुं स्तंशन करनार तथा ईष वस्तुनी प्राप्ति करनार पांचपरमेष्ठिना नमस्कारवाणी महामंत्र (नवकार) ज्यवंत वर्ते छे (सर्वथा अ-पिक छे), ए नमस्कार मंत्र मुक्तिने पछु सन्मुण करे छे (आपे छे) तो पटी भरुण्य, सुर अने असुरना ईद्रियुं पद आपे तेमां तो शुं आश्र्य ! हे राज ! जे केआध पवित्र थधने आ मंत्रनो निकाण वाप करे तो जेनी समये ईद्रिये प्रसन्न छे शेवा धर्म प्रसन्न थाय छे ” आ प्रभाणु कहीने ते सुनीदे पवित्रपण्याथी शेलता राजने शेकांतमां रुद्धस्य सहित पांच नमस्कार मंत्र आप्यो. ते मंत्रने पा-भवाथी लूमिपति अत्यंत प्रसन्न थयो अने शरीरनी कांतिवडे हिंशाओने उन्नवल करता सुनि आश्रामाणे उत्पत्ती गया. ते सुनीद्रिता दर्शनानंदना रसारवा हाती स्थिर थह गयेदो. राज ते उद्यानसांक उटलोड वणत कहीने पटी पौताना गृह तरह गयो.

ભાગ ધમ.

૨૪૩

ત્યારે પછી રામ રાજ પોતાની પ્રિયા સહિત દરરોજ વિધિ પ્રમાણે પંચનમભાર મંત્રનું ધ્યાન કરવા લાગ્યો, તેથી તેના દેશમાં સમય પ્રમાણે વૃષ્ટિ થવા લાગી. આપો દેશ રોગ રહિત, ઉપર્ક્રમ રહિત અને સરસ અભાસી જરૂર થયો. ગાયોના ઉધમથી પુંખારાની જે મ જરતા હૃદયથી જાળે તેના શ્વેત થયો હોય તેમ પૂર્વીશોભવા લાગી. તેના દેશ માંનના સર્વ પર્વતોમાં ભષિઓની. પાણે પ્રગટ થઈ, અને સર્વ અરણ્યમાં મહેન્મત હાથીએ ઉત્પન્ન થયા. આ પ્રમાણે સમય દેશ મહિદ્ધિ વૃદ્ધિ પાડ્યો.

અન્યથા રાત્રિના પાછલે પહોંચે જગૃત થયેલો રાજ વિચારવા લાગ્યો. કે— “અહો ! પરમેષ્ઠિ મંત્રનું ડેંબુ ગણ્યાત્મય છે કે જેના પ્રસાદથી મારું રાજ્ય અતિ મનોહર અને ધન્યાત્મને પણ સ્ફુર્ણ કરવા લાયક થયું ! પરંતુ હન્દુ સુધી ક્ષીરસાગરને ચંદ્ર આનંદ આપે તેમ મારા નેત્રને આનંદના સ્થાન રૂપ પુત્ર મને પ્રાપ્ત થયો નહીં.” આ પ્રમાણે રાજ વિચાર કરે છે તેવામાં તલકાળ નિદ્રા રહિત થયેલી તેની રાણીએ હર્ષના વિલાસની સર્પસી વડે મનોહર થઈ સતી તેની પાસે આવી વિજસ્નિ કરી કે— “હે મિથ ! લોકોએ અંજળી વડે પીવાતા અમૃત સમૂહને વરસાવતો, નિર્મણ કરુણાએ કરીને મલિન કલંકને દૂર કરતો. અને ચોરીદ્રાગે પણ અપેક્ષા સહીત જેવાતો ચંદ્ર મારા સુખમાં પ્રેયેશ કરીને મારા ઉદ્દરમાં રહ્યો, એમ મેં હમણાજ સ્વપ્રમાં હીઠું છે.” આ પ્રમાણે અદ્ભુત સ્વર્ણની અમૃત સમાન કથાનું શ્રવણું કરીને દોમાચિત થયેલો રાજ સુખકરુણમાંથી નીકળતી મહરંદ જેવી વાણી વડે આવ્યો. કે— “હે દેવી ! કલંક રહિત કણાથી શોભતો, ધર્માત્મા, મધુર આદૃતિવાળો. અને જગતના જીવનરૂપ એવો તારે પુત્ર થશો.” તે સંલઘણી ‘બહુ સાર્દ’ એમ કહીને રાણીએ પોતાના વખતે છેદે ગાંઢ વાળી. તેવામાં બહુર પ્રાતઃકાળને જણાવનારો શાખાનો મંગળ ધ્વની થયો. તે વખતે ઉત્પન્ન થયેલા હર્ષથી વાસિત થયેલો રાજ પ્રિયા સહિત એક કાણુવાર નમસ્કાર મંના ના ધ્યાનમાં મગ્ન ચિત્તવાળો થઈને રહ્યો.

ત્યારે પછી નમસ્કાર મંત્રના આરાધનમાં વિશેષ આદરસાળા થયેલા તે દંપતી દુઃખ માત્રને શમાવી હૃદાને દિવસેને નિર્ણયન કરવા લાગ્યા. ગર્ભસ્થિત પૂર્વ થયે જ્યાવળી રાણીએ શુલ હિવસે પૂર્વ ચંદ્ર સમાન સુખવાળો અને શુલ લક્ષણવાળો. પુત્ર પ્રસંગે, રાજને કે જે માણુસ પુત્રજન્મની વધામણી કહેતા હતા તેને અધિક આનંદવાળો. રાજ અધિક અધિક હિતામ આપતો હતો. રાજને લાં પુત્ર જન્મ થયો તે વખતે બંધનથી સુકૃત કરેલા તેના શરૂઆતે પણ ચિત્તમાં હર્ષ થવથી ઉત્ત્સવ થયો. આ પુત્ર ગર્ભમાં આવ્યો લારે તેની માતાએ પોતાના સુખમાં અંદ્ર પ્ર-

२४४

नैत धर्म प्रकाश.

वेश करते चयेहो हो तेथी ने स्वभावे अनुसारे रावत्ये ते कुंवरतुं अद्वैटादर  
अंतुं नाम पाठयुं ते आणक राज्यकलक्षणीनी साथे हिंसे हिंसे वृद्धि पामवा  
लाग्यो. ‘पाच परशेणिना नमस्कारनुं परिणाम उत्पोत्तम छे.’ आगूर्ज.

## त्रिव्युचर्य.

[ अनुसंधान पृष्ठ २२४ था ]

अमेधधमस्त्रा वहुरंग्रन्तिर्यन्, मद्वाविष्णोद्यन्, कृमिजावकीणी ।  
चापद्यमायन्त्रतर्चिका स्त्री, संस्कारमोहान्तरकाय जुकता ।

भावार्थ—विष्णुथी लरेती चामडानी डोथणी, बहु छिद्रेभांगी नीकलता  
मण ( मून विष्णु ) थी भद्रीन, ( योनिमां ) उत्पत्त थता दीडाओआथी व्यास, अपणता,  
भाया अने असत्य ( अथवा भायाभूषावाद ) थी इगनारी अथी श्वीओ पूर्व सं-  
स्कारना मोहुथी नरकमां जवा साढ़ज लेणवाय छे.

निर्मूमिर्विकंदली गतदरी व्याघ्री निराळ्हेमहा-  
व्यापिर्षत्युकारणथ द्विनाऽनभ्रा च वत्राशनिः ।  
वंवुस्नेहविवात साहस मृषावादादि संतापनुः  
प्रत्यक्षापि च राक्षसीति विरुद्धैः ख्याताऽऽग्ने त्यज्यताम् ॥

“ ( श्री ) लूमि वगरनी (उत्पत्त थयेती ) विष्णनी वेलडी छे, शुक्र वगरनी  
वाधयु छे, नाम वगरनो मोटो व्याधि छे, काश्यु निनातुं भुत्यु छे, आकाश वगरनी  
विज्ञणी छे, सगा अववा लाईओमां रनेहुनो नाश, साहस, मृषावाद विगेरे अंता-  
पेतुं उत्पत्ति स्थान छे अने प्रलक्ष राक्षसी छे. आवां आवां उपनामो श्वीओ भाटे  
आगमगां आपवामां आव्यां छे, माटे.तेन लघु दो. ”

( आ विषयमां अध्यात्मकठपुम नामा अथमां चयेक श्रीममत्प्रमोथना-  
पिकार आस ध्यान पूर्वक वांचवा लालाभयु उत्तरामां आवे छे. )

बहुरथी रम्य हेखाता श्वी शरीरनो अशुचि भाव विचारनामां ओगलीक्ष-  
मा तीर्थ कर श्री मदिलनाथनुं चरित्र घायुं उपकारक लघुय छे.

वस्तुनेतेना अस्त्र स्वृप्तमां समजनार, कामदेवना स पापामांथी अचनार अने  
श्वीनो लाग करनारनेज अरेखदो साथक योगी पुरुष कडी शकाय. कामदेवना मुख्य

અધ્યાત્મ.

૨૪૫

મહા શ્રી કટાકથી હુણાએલ ચિત્તવાળો ભાગયેજ આત્મિક ઉજ્જ્વાતિ કરી શકે છે.  
કામનેજ સર્વ અનથૈતું મૂળ ગણુવામાં આવે છે. તેને લુતનારનેજ લુતંદ્રિય કહી  
શકાય છે. કામદેવેજ હુલરો મોટા મોટા તપસિલોના તપનો નાશ કર્યો છે. ઘણુંજ  
ખુબીથી કટાક કરતાં વડોકિતમાં રસ્તુંહરી કામદેવને સર્વ હેવનો હેવ ગણી નીચે  
પ્રમાણે નમસ્કાર કરે છે.

શંકુ સ્વયંનું દરયો હરિણેક્ષણાનાં, યેનાક્રિયંત સતત ગૃહકુંચદાસાઃ ।  
વાચામોગ્રચરચરિત્વવિચિત્રતાય, તસ્મૈ નમો નગયતે કુમુમાયુધાય ॥

“ ને જગવાન કુસુમાયુધ (કામદેવ) ના પ્રલાવથી પ્રદ્યા, વિષણુ અને મહેશ્વર  
લેવા જગતના ગ્રાણ અધિષ્ઠિત દેવતાઓએ પણ કામનીયોના દાસ થઈ ગયા છે અને  
નેતું વિચિત્ર ચરિત્રાબીથી વદી શકાતું નથી તેવા જગવાન કુસુમાયુધને હું નમ-  
સ્કાર કર્યું.”

ખરી શીતે જેતાં તો વ્યવહારિક વિષયમાં કુશળ, સંસારનો પૂર્ણ અનુભવી  
રાજ્યિ રસ્તુંહરી કામદેવ તરફ ધિકારની નજરથીજ નુંએ છે. તે શતકના મંગળાચ-  
રણ ખાડ ખેલાજ શ્રોકમાં કણે છે કે—

યાં ચિન્તયામિ સતત મયિ સા વિરક્તા, સાધ્યાન્યમિચ્છરતિ જને સજનોઽન્યસક્તઃ ।  
અસ્મલ્કૃતે ચ પરિષુધ્યતિ કાચિદન્યા, ધિક્તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ ॥

‘ ને શીતું હું નિરંતર ચિન્તન કરું છું તે મારા તરફના તેના પ્રેમભી વિરક્ત  
છે અને પરપુરથની ધ્યાન રાખે છે, તે પુરૂષ ખીજુ શ્રીમાં મળું છે અને તેજ પ્ર-  
માણ્ય અન્ય શ્રી મારા ઉપર આસક્ત છે. (આ ઉપરથી ) મહારા ઉપર આસક્ત  
છે તે શ્રીને, તે પર પુરૂષને, મફનને, આ શ્રીને ( પંગળાને ) તેમજ રહુને પો-  
તાને પણ ધિકાર છે.’

આવી રીતે કામદેવ તરફ ધિકાર ઉત્પન્ન થતાંજ મહાન રાજવૈષણવના ધણી  
લર્તુંહરીની વૈરાગ્યવૃત્તિ રહુરે છે અને તે શતક ચતુર્થ્ય ૩૫ ઉપદેશક અન્યમાં  
પોતાના જત અનુભવનું સંખ્ય અને યથાર્થ ચિન્તાણ્ણીજ અસરકારક રીતે રહ્યુ  
છે છે. તેણે બનાવેલા ચાર શતકો પૈકીના ગ્રાણ શતકોને આભ્યાસ તો એટલો બધી  
દ્વારાન્ય થઈ પડ્યા છે કે સુશિક્ષિત વર્ગ ભાગયેજ તેનાથી અનાણ્યો હુશે. આ  
શતકનો આભ્યાસ કરી સારથાહી યુદ્ધિથી ઉચ્ચ નૈતિક વર્તન રાખી. વૈરાગ્ય લાવ  
આણુવાની જરૂર છે.

२४८

गेन धर्म अकाश.

કામદેવવિશવર્તી જી પોતાની મોટાઈ, પાંડીતાઈ, વિવેકીપણું' કુલીનતા-  
વગેરે સર્વ ગુમાવી બેસે છે. તે વિષે કહું છે કે—

તાવનમહૃત્ત્વ પાંકિંય, વિવેકિત્વ કુલીનતા।  
યાવજ્જવત્તિ નાઙ્ગેણુ, હન્તિ પંચેણુ પાયકઃ ॥

“જ્યાં સુધી પંચભાગ-કામદેવ અંગમાં પગઠચો નથી લાંસુધીજ માણુસની  
મોટાઈ, પાંડીલ, વિવેકીપણું' અને કુલીનતા જળવાઈ રહે છે.”

કામદેવને જે પુરુષ છુતી શક્યા છે તેમનેજ ધન્ય છે, તેઓનું આ દુનિયામાં  
હુમેશાં પૂજનીય છે, તેઓનું હુમેશાં હુચ્ચ સ્થાન લોગાને છે અને તેમનુંજ પરમ  
પરિવિન ચરિત્ર અનુકરણું કરવા ચેય્ય છે.

લગલગ દરેક સંપ્રદાયમાં અચરણાન ધરાવતા ગ્રહિયર્થ ક્રતધારી સાંધુ જનો-  
જ ગળી આવે છે. આપણું હિંહ ધર્મમાં તો શું બલકે ફિલ્ખિયન પ્રજામાં પણું આ  
વર્ગના રોમન ડેયોલીક પ્રીસ્ટસ fathers ના ઉધનામથી એણાખાતા મતુષ્યો  
છે, આ કલિયુગના સાગરયાં અતસાર્પિણી જાગરાં આ ચતુર્થે વતનું' માણાત્મય ઓ-  
ટલું' દેખવામાં આવે છે કે મતુષ્યમાં-સાંધુ પુરુષોમાં-શુરૂ વર્ગમાં, કદાચ અન્ય ગુ-  
રૂપું વિશેષ સારા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા નહિ હોય એતાં પણ જે તેઓ ગ્ર-  
હુચ્ચર્થ વતનું' મન, વચન, અને કાયાથી સરા સેવન કરતા હોય તો તેઓ અવશ્ય  
આપણાં પણ યુદ્ધ ઉત્પન્ન કરશે. હુંક સમય ખેળકાંજ સ્થાપિત થયેલ સ્વાની.  
નારાયણ સંપ્રદાય કર્દી પણ લોકિય થઈ પડ્યો હોય તો તે તેમના સાંધુવર્ગમાં જોવા-  
માં આવતા ગ્રહિયર્થના પ્રસાવનેજ આલારી છે.

સુધરેલી દુનિયામાં દેખણું સંપ્રદાય તેમના આચાર્યોની ગેસ્વર્તલુકને લઈને  
જગણીનીએ ચઢેવ હતો, તેનું કારણ પણ શોધવા જરૂર ફેદે તેમ નથી. પરકાય પ્ર-  
વેશ વિદાનો ઘણીજ વખાણવા ચોય્ય રીતે (?) ઉપયોગ કરી અમરક રાજના શાખ-  
માં પ્રવેશ કરી તેની રાણીએ (પદ્મા) સાથે લોગ જોગવનાર શ્રીમાન્ આદ્ય શાંકર-  
ચાર્યના વર્તન માટે શું વિચાર કરવો? વળી કાશ્મીરમાં આવેલા શારદામંદીરમાં  
દક્ષિણ દ્વાર ઉધારી પ્રવેશ કરી સર્વજ્ઞપીઠ ઉપર અડવા જતી વખતે પોતાના આશુદ્ધ  
વર્તન માટે શારદા દેવી તરફથી આટકાવવાના આવતાં અન્ય શરીરે લોગવેલ પાણ-  
નો આં શરીરને લેખ લાગી શકે નહિ એવો જે તેમણે શુલાસો કરેલ તે શિષ્ટ જન-

अक्षयर्यं.

२४७

समाज कथुत राखें के केम ? ते पष्टुविचारवा. जेवुं छै. अहस्थ गुरु होइ शके  
 के नहि ? ते प्रश्ननी चर्चामां उतरवानो। अन् असंग नथी, परंतु कैन दृष्टिए तो  
 एमन कडवुं पडे छे के अन्य शुणो छोवा साथे धर्मगुरुओमां की अने द्रव्यनो  
 लाग लाव पषु अवश्य होयो। नेहिए, ते वगर तेमनो उपदेशज असकारक होइ  
 शके नहि. नाटकमां लज्जातां वेषचाली मुझपेना विवेचनथी-उपदेशकारक लाखणोथी  
 केम ज्ञाने तेवी सारी असर थवा संलव नथी, तेवीज रीते माज्योभामां वधत  
 गुमावता, पारके पैसे तागडाधिना करता, सज्जसी वैखव लोभवता-धर्मोचारी पषु  
 लेइए तेवा सारा प्रभाष्यमां लाल आपी शके नहि. प्रेमला लक्तोमां कंधक ज्ञेवा-  
 मां आवतो व्यक्तियारनो हुरुंबुं तेमनाज हुष्ट वर्तनने आभारी छे. मोटा मोटा  
 पग्गरहार शास्त्रीयो। राखी अल्यास करवामां आवे तेथी शुं ? अनेक  
 दर्थनशास्त्रेना अल्यासथी मेणवेली विचक्षणताथी शुं ? मोटी मोटी भानपह  
 सकार तरट्थी अगर विश्व विद्यातय तरट्थी दीशीयो—पदवीयो। प्रास करी होय  
 तो तेथी पषु शुं ? न्यांसुधी वर्तन सुधर्युं नथी—यारित्र सुधारी शकायुं नथी त्यांसुधी  
 सर्व नकामुंज छे. एक अंग्रेज साक्षर कहेछे के 'क्वयित असाधारण विद्रतानी सा-  
 थे द्वितीयामां हलका हुरुंबुं होयछे' उच्च यारिनन विद्या साथे संभूध नथी. शुद्ध या-  
 रित्र रहित जानीतुं सान मान आड़भर झूपज छे. आ कारण्युथीज भानसिक डेव.  
 दीथी अंतःकरणुना डेववाली युठी पडेछे. अतःकरणु डेववायावगर-नैतिक वर्तन सुधयो  
 वगर मानसिक डेववाली कंधपषु कामनी नथी. झट्टर हेघाव सारो राख्याथी-उपरनी  
 टापटीपथी कदाच व्यवहार दृष्टिए अहस्थ गुरुओ। मान प्रतिष्ठा मेणवी सक्षे अरा  
 परंतु विवेकी ज्ञने-तत्त्वनी गवेषणा करवावाणा पुढेयो तो तेमनाथी से हाथ द्वरज-  
 रहेयो. संसारिक कार्योमां कदाच तेच्चो। उपकारक थई पडेयो परंतु धार्मिक निषयमां तो  
 उलटा तेच्चो। माटी असर करनारा थई पडेयो, जे लक्षकरनो सेनापति तुट-आंधेना  
 होयठे जे लक्षकर आड़मां परीविनशन आगेके। तेवीज रीते जे संप्रदायवा-  
 धर्मगुरुओ। मोहनध बनी संसारमां आसक्त थयेवा होय छे ने।  
 ती परिष्युमे उच्च स्थिति कध रीते होइ शके ? अ-  
 चित्तवृत्ति सामान्य रीते एवी तुम्ह छोय दे।  
 अी तेमना अहवर्तनन्तुं अतुकरणु करवा पेह-  
 ध्यान आपी चोतानी तेवा प्रकारनी जोड—अ-

१ लुण्या माधवनायाये दृत संकर दिग्गविज्य,

ज्ञान  
देव  
हृषीकेश,  
मीमांसा

२४८

जैन धर्म प्रकाश.

लक्ष्यार्थीनये छे, आवा अनेक कारणोने लधने धर्माचार्योंचे अवश्य कीनो। त्याग करवेा जेईचे अने भन वयन कायाथी सहा अहंकार वतनुं पालन करुं जेईचे, आ विषयमां शास्त्रारनुं इरभान पण ऐवुं छे के अशुल कर्मना उदयने लधने कठाच अहंकार वतमां सणवतना थाय तो साधुचे तदन नवेसरथी-इरीथी दीक्षा लध वत याणवामां दृढ रहेवुं श्रीभान हुरिकद्रसूरि आ वतनी विद्धना वर्तनं स-धगां प्रझपे छे के—

**मुद्वं चैतपर्मस्य, ज्ञवनायपर्वनम्। तस्माद्वियाननक्त्याज्यं, इदं मृत्युमनिच्छता॥**

लावार्थ—( अथदार्थ ) अधर्मनुं भूण छे अने लवनी परंपराने वधारनार छे तेथी भूत्यु नहि धृच्छवावाणाचे विषभिश्रित अक्षनी माझक तेनो त्याग करवेा योग्य छे।

युद्धमां-रणुसंथाममां उतरी देशनुं रक्षणु करनारा सैनिकेनुं शरीरणा अविचिक्ष रीते जग्वाई रहे तथा कुटुम्बज्ञान ३५ उपाधिथी तेवा मुक्त रहे ते गणुनीमेऽन्तरकार तरक्षी तेमने अविवाहित राणवामां आवे छे। तो पछी समरत अहांड उपर एकातपत्र राज्य याणवतनार, युक्तवर्ती केवा भहान राज महाराजानेने तये हेवेन्द्रने पण योतानी आज्ञाने आधीन राणवनार मोहराजानी सामे युद्धमां उतरनार आत्मगुणुरक्षक धर्मवीरोंचे अहंकार के भ न पाणवुं ?

अथदार्थथी-सैयुन सेवनथी शरीरमां अनेक प्रकारनी व्याधिये। उत्पन्न थाय छे एट्टुंज नहि परंतु मानसिक स्थिति पणु सारी रही शक्ती नक्ती आधि, व्याधि अने उपर्युक्त नव्ये पोतानो। होऽयथार्थ रीते ज्ञमावे छे।

**कम्पः स्वेदः असो मूर्च्छा, भ्रमिग्वानिर्विद्वक्यः।**

**राजयद्वादिं रोगाच्च, ज्ञवयुमेयुनोत्तिताः॥**

“कृप, स्वेद, थाक, मुर्च्छा, शरीरनी निस्तेज अवस्था, खलनो नाश अने क्षय रोगाहि अनेक प्रकारना देवो मेयुन सेवनथी उत्पन्न थाय छे。”

अहांकार चारित्रनुं भूण छे। अहांकारथी संक्षेप अण वृद्धि पामे छे। अहांकार वृत्तिज वैराग्यने। अरं। रांग ज्ञानवामां मुख्य साधन छे। अहांकार वतना प्रभाव-थी अनेक उपदेवेनो नाश थाय छे। भूत प्रेत पिशाच विगेरे क्षुद्र देवताओ। अहांकार दीन केअपणु प्रकारनी पीढा उपनत्वी शक्ता नक्ती, न्याय विशारद धीरुद धारक उपाध्याय श्रीमह यशोविजयल नीमनिषित चतुर्थी पापस्थानकनी सञ्चायमां अहा-क्षर्यनां प्रलावनुं धारुंज साकृं स्वरूप प्रकाशे छे।

અક્ષરચર્ચ.

૨૪૬

### તુમે ખાડુ ભિન્નીરે સાહેભા—એ દેશી,

પાપસ્થાનક વૈશ્વ' વળ્યિ, હુગ્નિ મૂલ અભંલ; જગ સની સુંખ્યો છે એહામાં,  
છાડે તેહ અચંલ ॥ પાપ૦ ॥ ૧ ॥ રહું લાગે છે એ ધૂરે, પરિણામે અતિ ફૂર; ઇન  
કિપાકની સારીઆ, વરને સજજન હૂર ॥ પાપ૦ ॥ ૨ ॥ અધર વિદુત સિમત કુલાં,  
કુચ્છણ કઠિન વિશાલ; રામા હેણી ન રાચીયે, એ વિષવેલી રસાસ ॥ પાપ૦ ॥ ૩ ॥  
પ્રભાળ જ્વલિત અથ પુતળી, આલિગન લલુ' તંત; નરક હુઆર નિતાંની,  
જગન સેવન એ હૂરંત ॥ પાપ૦ ॥ ૪ ॥ દાવાનલ શુણ વનતણો, કુલ મ-  
શી કૂર્ચીક એહ; રાજ્યાની મોહરાયની, પાતક કાનન મેહ ॥ પાપ૦ ॥ ૫ ॥ મલુતાએ  
હરિ સારિયો, રૂપે મયણ(મદન) અવતાર; સીતાએ રે રાવણ ધથા, છાડો પરનર નાર  
॥ પાપ૦ ॥ ૬ ॥ દશ શિર રજ માંદે રોલીયા, રાવણ વિવશ અભંલ; રામે ન્યાયે રે  
આપણો, રોધ્યો જગ જ્યથંલ ॥ પાપ૦ ॥ ૭ ॥ પાપ અંધાયેરે અતિ ધાણુ', સુકૃત સ-  
કળ ક્ષય જ્યા; અથવાચારીનું વિતંયું, કદિય સંક્રાન્ત નવી થાય ॥ પાપ૦ ॥ ૮ ॥ મંત્ર  
કૂળે જગ જસ વધે, ટેવ કરે રે સાનિધિ; ધ્રમાર્થ ધરે જે નરા, તે પાણે નવ નિધ ॥  
પાપ૦ ॥ ૯ ॥ શોક સુર્ધર્થનને ટળી, શૂળી સિંહાસન હોય; શુણુ ગાયે ગગને રે દેવતા,  
મહિમા શિથાનું ન્યે ॥ પાપ૦ ॥ ૧૦ ॥ મૂળ ચારિનું એ લલુ', સમક્રિત વૃદ્ધિ  
નિદાન; શિલ સલિલ ધરે લુકે, તસ હુએ કુજસ વખાણ ॥ પાપ૦ ॥ ૧૧ ॥ ..

અધ્યાર્થ પાળનાર પુરૂષનું શરીરણ તેમજ મનણ એટલુ' બધું વિસ્તિષુ'  
ઘીલેલુ' હોય છે કે ગમે તેટલુ' સુરકેલ કાર્ય પણ તેને મન તદન સુતર જણાય છે.  
ચક્રવર્તી રાજયો તથા દેવેન્દ્રો પણ અધ્યાર્થારીના ચરણુ કેમળાની ઉપાસના નિરંતર  
કરે છે. અભંડ ધારાએ અધ્યાર્થ વત પાળવાચી વીતરાગ દશા પ્રાત કરી શકાય છે.  
ક્ષાણિક વિષયસુખને માટે અધમ પુરૂપો અધ્યાર્થમાં રખાયિત થાય છે, પાપાચરણ  
સેવે છે, અને મહા હુંખાના સ્થાનભૂત નરકગતિમાં સથકાય કરે છે.

જં ચ કામ સુહું લોએ, જં ચ દીવં મહા સુહં ।  
વીયરાપસુહસ્તેયંતજાગંપિ નગ્યઃ ॥

“લોકમાં એ વિષયાદિક સુણો છે અને દેવલોકમાં એ મહા સુણો છે તે સર્વ  
સુણો વીતરાગના સુખ પાસે અનંતમે લાગે પણ થતો નથી.” ક્ષાણિક સુખને  
માટે ધન્દીયોને વશ થઈ, અથવાર્થમાં ફસી પરી, અક્ષય સુખનો લોગ સદાને મા  
ટે આપવાતું કયો વિચારશીલ યોગી પુરૂષ પસંદ કરેશો? અનાદિ કાળથી આ ચે-  
તન મૈયુનસંસાને વશ વતી વિષય સુખમાં લીન થતો આવેલો છે, છતાં દેવને પણ

२५०

जैन धर्म ग्रन्थाश.

हुद्देश आ मनुष्य सत्त्वमां प्राणी आत्म गुण अकट करेता ग्रथास करते नथी. एके-न्द्रीय छु तरीकेनी स्थिति होय छे त्यारे पशु आ लव मैथुनसंज्ञाने आधिन वर्तते। कछेवामां आवे छे. करणु के अशोक वृक्षने ची पगनी लात मारे छे त्यारे निकास पर्मे छे, बफुव वृक्षपर स्तो ज्यारे द्वाइनो डोणगो नापे छे त्यारे ते शोक त-लु हे छे, कुरुणक वृक्षने ची आदिंगन करेछे त्यारे ते प्रकुष्टित थाय छे अने तिलक वृक्षनी सामुं ची ज्ञुओ छे त्यारे तेने इणीओ आवे छे, वगी पशु कहु छे के-आहार निद्रा जय मैयुनं च, सामन्यपेतत्पशु जिन्नराणाम्। एटवे के आहार, निद्रा, जय अने मैथुन पशु तेमज्ज मनुष्य सर्वने सामान्य छे. मैथुन संज्ञाने त्याग करी तेना उपर छुत मेणवी पेतानुँ कार्य साधवामांज मनुष्येनी पशु वगेरे करतां श्रेष्ठता रहेली छे. स्पर्शेन्द्रीयने छुतनारा मनुष्यज्ज व्यक्षयर्थ तत पाणी शके छे, तेथी विपरित स्थितिमां रहेनार मनुष्यने अनेक संकटो सहन करवां पडे छे. स्पर्शेन्द्रीयने वश पडीने हुस्ति महा हुअ पामे छे. हुस्तिने पकडवा माटे एक भोटो आडो ज्ञाही, तेने अडथी ढांडी हर्य, आडानी भीजु आज्ञुओ एक सुंदर जनावरी हाथयां उल्ली करवामां आवे छे अने तेनापर आसक्त थयेको। हाथी होडवा ज्वां एकदम आडामां झुस्ती पडे छे. ची संधेग जन्य स्पर्शेन्द्रीयनुँ सुख दृप मनातुँ कार्य महाआपत्तितुँ करणु थई पडे छे.

## सत्य-पंचम सौजन्य.

अनुसंधान पृष्ठ (२१८) थी.

सत्य वयन योग, असत्य वयन योग, सत्यभूपः वयन योग अने असत्य-भूपा वयन योगनुँ स्वदृप ए प्रकारे विचार्युः हुये एमज संबंधमां असत्यने अंगे पांच मोटां जुडां न योदवा माटे शिष्ट ज्ञो वारंवार आथहु करे छे ते मोटां अथवा मोटां जुडांनुँ स्वदृप विचारीओ. वेविशाणना भ्रसंगे भराखर ध्यान राखीने ज्ञेयो तो कन्याना संबंधमां अनेक ज्ञाती हुक्कितो तेमज लगती हुक्कितो दांबलवामां आवशे. 'दृप ठीक्छे, वणी हुणु तमारे त्यां आशो खीशो अने सारां कपडां पहुरेये एटवे वधारे शेल्ली नीकपशो.' आक्रिकाना हुणसी साथे हुरीक्षाई करे एवा दृपवाणी कन्या माटे पशु आवां वयन सांबज्यां छे. 'अख्यास केटवेक क्यो छे, विशेष करवाना दृश्य छे अने यादास्त बहु सारी छे' आवां वयन पाठीपर धूप पशु न नाखी होय के 'मा खा छे' एटहुं पशु वांचतां न आवडतुँ होय तेवी

## सत्य-पंचम सौन्दर्य.

२५२

कन्याओने माटे वयरातां सांखण्या छे. तेवीज रीते तेनी गति, चालाकी, वयनो-  
व्यार, वर्ष्यु, रंग, अवयास, वय, कुण, वर्तन विजेरे विजेरे अनेक बाखतोमां  
धरादा पर्वड असत्य बोली वेविशाण करनार अविष्यना वरना पक्षवाणने छेतर-  
वानी अनेक प्रकारनी जागो पाथरवामां आवे छे. तेने 'कन्यालीक' क्लेवामां  
आवे छे. कन्यालीक शण्डमां द्वीपह स'ब'धी सर्व प्रकारना असत्यनो समावेश  
करवानो आहेश छे. परंतु एमां प्राधान्य कन्याना विषयने छे, अनुं कारणु एना  
प्रसंगे अहु आवे छे अने अनां परिषुभं लांभा वयत सुधी चालनार अने  
अहु व्याधात करनार अने केटलीकवार अहु लयंकर थर्ह पडे छे, ते छे. ते कारण-  
सर एने मोटकुं नुकुं क्लेवामां आवे छे.

'गवालिक' आ मोटा नुठानो धीने प्रकार छे. जनावर एोछुं 'दूध करतु'  
होय तेने रागे करीने वधारे हृष्ट करनार जणुववुं अथवा द्वेषथी एथी उलटुं  
जणुववुं ए गवालिक छे. आ अने हृषे पठीनुं अलिक मोडुं शा भाटे गणुवामां  
आनुयुं छे ते शहेना रेहेवासी करतां गामडाना रेहेवासी जलदी समल शक्शे.  
ए तेअनो दररेजना अनुक्षवनो विषय छे. नीलुं 'भूम्यलिक' ते जभीन  
स'ब'धी असत्य गोलवुं. रसाण लूमिने उधर लूमि क्लेवी, वेरान जभीनने झण-  
टुप क्लेवी, एनी लांगाई पहेणाई क्षेवङ्गा गोटां क्लेवां विजेरनो. आमां समावेश  
थाय छे. उपर जणुांयुं तेम कन्यालिकमां सर्व द्वीपह स'ब'धी असत्यनो समावेश  
करवो, गवालिकमां सर्व चतुर्पह स'ब'धी असत्यनो समावेश करवो. अने ने शण्डो  
भूया छे ते ते वर्गनी अभुक व्यक्तिओनी मुण्यता णताववा भाटे भूडेला छे.

थापणुमोसो ए चोथुं मोटकुं नुकुं छे. विश्वासथी डोई भाण्स परदेश  
जती वयत घरेलुं भूझी नाय, रोकड मूळी नाय अथवा धील वस्तु भूझी  
नाय त्यारे साक्षी राणे नाडि, एवानो विश्वासधात करवो, ए वस्तुओ. पाठी लेवा  
आवे त्यारे असत्य बोली ते भुझी गेयेल वातनी धनकारी करवी ए चतुर्थ महा  
असत्य छे. 'कुडोसाक्षी' ए पांचमुं मोडुं असत्य छे. पोतानो केस साचो करवा  
भाटे पोते न्याय दरभारमां असत्य साक्षी सोगनपर आपवी अथवा धीन मोटा  
साक्षीओ. उला करवा ए महान असत्य छे. रागथी के द्वेषथी नुडी साक्षी पुरवाना

१ आ असत्य नीन पापस्थानक (चोरी) मां पशु समाय छे, मान शान्त्या ना पाऊ  
अडका अंशन; आमां समास छे.

'કારણસૂત્ર ધનાર આ વિલાગની કક્ષામાં આવી નથ્ય છે.

સત્ય અને અસત્યના વિશિષ્ટ પુરુષોએ ને વિલાગ પાડ્યા છે અને બેદો ખતાંથા છે તેનું કાંઈક સ્વરૂપ આપણે જેણું તેથી સત્ય શું અને અસત્ય શું? તેનો ખ્યાલ આવી શકશે, જેથી આપણે સાધારણ શુદ્ધિશી સત્ય માનતા હોઈએ તે અસત્ય પણ હોય એ ઉપરના સૂક્ષ્મ વિલાગોથી જેઈ શકાયું હોશે. ગમે તે દિનિથી જોઈએ તો સત્ય વચન ગોલવાથી લાલ છે એ નિઃસંહેઠ હુકીકત છે. સત્ય વચનની વ્યવહાર ચાલે છે અને વ્યવહારમાં અનેક પ્રકારના લાલ પણ તેથીજ થાય છે. અસત્ય બોલીને કદાચ થાડો વખત કાંઈ લાલ મેળવવામાં આવે છે પણ પરિણારે તેથી લાલ થતો નથી અને જરૂર નુકશાનજ થાય છે. ડોઈ પણ બાપારતું સાધારણું દ્વિતીય લઈએ તો આ વાત તરત સમજશે. તોલમાં, માપમાં, લાવમાં, સોદામાં, રૂખ ખતાવવામાં અને ધીજુ અનેક બાળતમાં સત્ય ગોલનાર વેપારીજ ફૂવે છે. થાડો વખત કદાચ ગોટી હુકીકત કહેનાર ફૂલી જાય છે પણ છેવટે તે ઉઘાડો પઢ્યા વગર રહેતો નથી અને જ્યારે તેનું અસત્ય વર્તન ધીજના જાણવામાં આવે છે ત્યારે જરૂર તેના બાપાર ઉપર ભાડી અસર થાય છે. આહુકો એક વખત છેતરાય છે પણ અંતે તેઓ અસત્ય ગોલનારને છોટી ફર્ધ સત્ય વ્યવહાર કરનારનો આશ્રય લે છે, એ હરરોજના અનુભવનો વિષય છે. સત્ય વ્યવહાર કરનાર બહુ સારો વિશ્વાસ પાડી શકે છે અને કદાચ શરૂઆતમાં તેને સહુન કરવું પડે છે, કેટલાક નદ્દોનો અને ઘરાણિનો લોગ આપવો પડે છે પણ છેવટે તે જરૂર ફૂવે છે. હુનિયાનો વ્યવહાર પણ સત્ય ઉપરજ ચાલે છે. હુનરો માઈક્રોપરથી માલ મોઝનાર જે એક વખત ભરતીઆમાં લખ્યા કરતાં એછો માલ મોકલે તો કદાચ એકવાર તો નદ્દો મેળવી જાય પણ ધીજુવાર તેનાપર ડોઈ અરીદ મોકલતું નથી. વળી અસત્ય ગોલનાર પણ સત્યના આશ્રય નીચેજ પોતાનો વ્યવહાર ચલાવે છે અને લાલ મેળવે છે. દરેક બાપારી 'એક જ લાવ' ના પાટીઓ હુકાન પર લગાવે છે. 'આ હુકાન પર એ લાવ છે' એવાં પાટીઓ ડોઈ પણ જગો પર વાંચવામાં આવ્યાં નથી. તેથી કદાચ 'એક જ લાવ' નું પાટિયું લગાડનાર પણ એ લાવ કરતો હોય તો અહુજ થાડો વખત નલે છે. અમુક અપવાહ વગર છેવટે તો પ્રમાણિક વ્યવહાર કરનાર અને સત્ય ગોલનાર જ ફૂવે છે. સત્ય વચનોચ્ચાર કરવાથી આવી રીતે વ્યવહાર દ્રિથી પણ અનેક લાલ થાય છે. મુખ્ય લાલ તેથી વિશ્વાસ બેસવાનો થાય છે અને એક વખત ચોકસ ફૂલાચ મેસ્સી ગયા પછી નિયમિત રીતે વ્યવહાર ચાહ્યા કરે છે અને બાળક પણ ફૂકાન પર બેન્ની સોડા કરી શકે છે. સત્ય વચનની વિશ્વાસ બેસે છે, વિશ્વાસથી યશ

सत्य-पंचम सौमन्त्र.

२५३

वधे छे, धर्शथी कीर्ति प्रसूचे छे, कीर्तिथी कोक्षिय थवाय छे अने लोक्प्रिय थवाथी स्वार्थ साधी शक्य छे, चैसा पेहा कराय छे अने योग्य साधन प्राप्त करी शक्यछे.

सत्य वयनथी आवी रीते व्यवहारू रीते व्यापारमां लाभ थाय छे, तेवीज रीते खील गंगे ते व्यवहारनी प्रवृत्तिमा पषु संभ्याबध लाभ थाय छे. एक वडील होय ते सत्यज सलाह आये छे अवेद विचार दोङेमां दृढ छपाइ गया पछी तेने काम करवानी पषु कुरसद न मणे अटेला लाभ थाय छे. अमां धीरज अने वयतनोज सवाल भाडी रहे छे, परिणामे तेने लाभ थवामां शांक रहेती नथी. राज्यदारी.पुरुषे, मुत्सहीयो अने कारबारीयोना संभधमां पषु तेज प्रकारे सभलु देवुँ. जेअमा दूर नीतिनो आश्रय करनार होय छे तेओना सीधा व्यवहारू के वयन पर पषु अनेक कृपनायो. करवानुँ कारणु अने छे, ज्यारे सरल प्रकृतिना नअ राज्यदारीयोना संभधमां मनमां किचित् पषु लय रहेतो नथी अने तेओ. धाखु सुकृत्ये करी नय छे, करी शक्य तेवी स्थितिमां भूक्षय छे अने वगर शांकये दोङे. तेनामां विचास भूडी तेना वयनपर विचास राए छे. आवी रीते कैधपषु व्यवहारनी प्रवृत्ति पर विचार करतां जाणुयो के सत्य वयनथी आ भवमां पषु अनेक प्रकारना लाभ थाय छे. सामान्य युद्धिये पषु ये लाभ एटेला अधा जाणुयो उे परलवना संभधमां जेना विचारा परिपक्व थयेला न होय ते पषु कांध नहि ते ऐहिक छित आतर पषु सत्य वयनोऽथारनी महत्वता सभलु शक्यो. सत्य वयनथी अन अहु रथूल लालो अताव्या ते उपरांत तो खील धाखु प्रकारना लाभ छे जेपर समर्थ रीते आप्यु आगण विचार करयुँ. हाल वयन योतवामां केटली जातनी दृष्टि राखवी ते पर ध्यान आपीये.

सत्य वयन योतवानो निर्णय करवो तेमां पछी कांध जोटा वाऱवा न जेइये. आये माटे त्रषु भूम ध्यानमां राखवा योग्य छे. 'सत्य योलो, पूँज सत्य योलो अने सत्य सिवाय कांधपदु योलो नहि.' आ निचारवा योग्य विषयो छे. धर्णी व घर्ते जेटलुँ वयन योतवाय छे तेटलुं तो सत्य होय छे पषु ते पूँज सत्य होतु नथी अथवा ते एवी परिभाषामां रथवामां आवयुँ होय छे के योतवार-जेटलुँ योले तेटलुँ सत्य होय पषु तेना परथी जे अलुमान होरवानुँ होय ते प्रगट असत्य होय अने योतवार ते जाणुतो पषु होय के सामेभाषुस तेने असत्य रीते सभज्यो. एक माणुसने पचीश इपियानो खप होय, तमारे तेने ते आपवा न होय, ते तमने आवीने पूछे के 'तमारी पासे पचीश इपिया छे ?' तमारा औसामां

२५४

जैन धर्म प्रकाश.

त होय पणु कपाटमां होय, तेथी तमे कहो के 'मारी पासे नथी' अने एम भानो के तमे सत्य बोल्या छो, पणु ते संपूर्ण सत्य नथी. तमारी पासे नथी एम बोलवामां तमारा लावार्थ एम छे के तमारा कण्ठमां के तमारी आलुभानुमां ते रक्म नथी, तमे ते वर्णते तमारी पासे गोट्ये शरीरपर नथी एम भानी सत्य ज्वाण आयो छे एम गणो छो, पणु तेज वर्णते तमे नाहो छो के सामो भनु-ध्य तेनो अर्थ एवे! कर्दो के तमारा कण्ठमां के तमारा घरमां ते रक्म नथी. माटे आ असत्यन छे, ते संपूर्ण सत्य नथी. वणी आपणे धृषी वर्णत एवी रीते शुच-वघुवागुं वाक्य बोलिए छी ए के सत्य होय, आणुं सत्य होय पणु ते सत्य सिवाय धीनुं पणु होय. योहुं वाक्य साचुं होय अने योहुं योहुं होय. योडो निभाग दी अर्थी होय, सामा भनुध्यने एटे रस्ते होरनार होय, उलटो आशय समज्ञी उलटी अनुभिति करावनार होय, ए सर्व सत्यनी कक्षामां आवतां नथी. हरदैज आवां नियम वर्णने खडु बोलाय छे अने तेटला माटे न्यायमहिरोमां हात प्रतिज्ञा देती वर्णत पणु सत्य बोलवाना, संपूर्ण सत्य बोलवाना, अने सत्य सिवाय काईपणु नहु बोलवाना जोगन देवामां आये छे. आ आणत खडु विचार कुरी समज्ञा योग्य छे. हरदैजना अनुभवनो विषय छे. कहेवानो तात्पर्यार्थ ए हे के मात्र सत्य वर्णन बोलवानो आदेश नथी, पणु तेनी साधे उपरोक्त खने वधारना नियमो पणु कामे लगाऊ होय त्यारेज ते सत्य कहेवाय छे.

उपरना वाक्यमां वे वणु नियमो सत्य बोलवाना संभवमां भताववामां आ०या छे तेने आपणु (जैन) परिभाषामां 'तथ्य' शण्डमां समाववामां आव्या छे. तथ्य वर्णन बोलवुं एट्ये जेवुं होय तेवुं अराखर बोलवुं अने कहेनारना आशय ने संपूर्णपणु अराखर सांस्कृतिक समजे एवी रीते कहेवुं. आ उपरांत जैन थं-योमां तेने माटे धीन पणु नियमो छे ते खडु विचारवा योग्य छे. सदरहु विशेषणो मुख्यते करीने चार छे. सत्य, प्रिय, हित अने तथ्य ए चारे विशेषण युक्त वर्णन बोलवुं एयो. सर्वज्ञ अग्नवाननो आदेश छे. अमुक विषयपर ज्यारे उद्देश करवाना होय लाई ते विषयनी मुख्यता करती वर्णत साधारणु रीते धीन विषयोनी योग्यता करी देवाय छे. ए होय हूर करवो अहु मुरक्केव छे. पणु आभा जन शास्त्रानो आशय समज्ञवा साहु एक हुक्कीकत खडु ध्यानमां राखवा योग्य छे. "अदिसा" उपर आभा जैन मतनी रचना छे. कोईपणु कार्य न करवुं, कोईपणु ज्ञेनार करवो अथवा न करवो, कोईपणु कधार न करवो, कोई वर्णन बोलवुं के न बोलवुं, कोई व्रत पञ्चाम्याषु लेवां, कोई नियमो स्वीकारवा ए सर्वमां अहिंसा

सत्य-पंचम सौऽन्तः४०

२५५

मृत बिपर दृष्टि प्रथम राखवी जेहजे, केनशाक्षमां अहिंसातुः स्वरूप ऐलुः उत्तम  
रीते आंधवामां आत्मुः छे के तेमां सर्वनो समावेश थै जय. लावप्राणु हृष्णाय  
तेवी पथु छिया करवानो निषेध थयो एटले ऐमां सर्व वत नियमोनो समावेश  
थाय छे. सत्य वयन भोलवानो आहेश क्यों तेमां ठीलु हडीक्त साथे मुख्य  
वात ए कही के असत्य वयन भोलवायी पेताना लावप्राणु हृष्णाय छे, ते भाव-  
हिंसा छे तेथी ते न भोलवुः. तेवीज रीते वयन सत्य छेय, संपूर्ण छेय, पथु सां-  
भणनारने अप्रिय लागे तेवुः छेय तो ते पथु न भोलवुः. कारण सामा भनुधनी  
लागणी हुभववी ए पथु हिंसा छे अने हिंसानो सर्वथा निषेध छे तेथी अप्रिय  
वयन पथु न भोलवुः. आ नियमना संभाधमां उपर उपरथी निचार करतां तो  
मान प्रिय भोलनार भाष्यस भुशामत करनारे थै जय एम लागवा संखव छे.  
कारण प्रिय वयनाज भोलवानी टेव पडे ते भाष्यस सत्य तरट नजर न राखतां  
प्रियता तरट नजर राखवा जय छे अने तेम करतां भुशामत करवानी टेव पडे छे.  
आटला उपरथी आस सभजवा योग्य ए छे के कैन शाक्षमां कडेल सर्ववयनो  
अपेक्षित छे. जे दृष्टिभिंहुथी ते इरमाववामां आत्मा छेय ते अपेक्षाया  
समजवी जेहजे. लघु वयना पुनर्ना हित भातर तेने अप्रिय वयन कडेलवामां आवे  
के न्यायाधिश गुन्डेगारने चेतवणी आपतां आकरा शण्हो कडे ते अप्रिय छे पथु  
असुक शुद्ध आशयथी उत्पन्न थयेला छे तेथी ते हिंसानी कक्षामां आवता नथी.  
आटला भाटे घनतां सुधी सत्य, प्रिय, हित करनार् अने जेवुः छेय तेवुः संपूर्ण  
सत्य कडेलुः. अप्रिय छेय अने भोल्या वगर चाले तेवुः छेय अथवा भोलवायी  
कांध लाल करे तेवुः न छेय तो भोलवुः नहि. महा हित करनार वयन छेय अने  
ते कटि जरा अप्रिय लागे तेवुः छेय पथु हितकारी चोक्स छेय तो थांडा तुकशाननो  
विशेष लाल भातर लेग आपवे. एक नानो छेकरो लाकडीना घाडा णनावी रम-  
तो छेय तेने लाकडी दूर लेवानुः कडेलुः ए असत्य वयन छे, कारण त्यां स्थापना  
निक्षेपानो लंग थाय छे. लाकडी उपर अक्षत्वनो आरोप तेणु क्यों छे, तेने घाडा  
दूर लेवानुः कडेलुः जेहजे. तेवीज रीते आंधने आंध कडेवो ते सत्य वयन छे,  
पथु अप्रिय लागे तेवुः छे, तेमज हित करनार् नथी तेथी तेने असत्य वयन कहुं  
छे. आ चारे नियम ध्यानमां राखी वयन भोलवुः, लाल हेखाय तोज भोलवुः अने  
नहि तो मौनं सर्वार्थं साधनम् समलु युप रहेलु.

आ चार नियमनी सायेज एक 'मित' विशेषपथु पथु व्यवहार रीते णहु उ-  
पयेगी छे. मित एटले भापेलुः वयन भोलवुः. अजग्नं तार करता छाईजे त्यारे-

૨૫૬

## जैन धर्म प्रकाश.

क्रीन अने तेम शब्दों ओएठा करवानी वृत्ति राणीचे जीवे तेवी रीते जड़र भूताना शाश्वत समजवे तेटवा शणहोऱ जोालवा; नकासुं आणो. हिवस जोाल जोाल कठुं नहि. असुस करीने के वयन जोालवाची महान अष्टित थतुं होय ते वयन कठि पणु जोालवुं नहि. वयन केवुं जोालवुं अने तेनो आवार हिंसा उपर छे ए जाते आणतोने लधने एटवा विकट प्रश्नो बिडवा संभवित छे के ते पर विवेचन थई शके तेम नथी, पणु उपर कछुं छे ते हकीकित अस्सपरम एवा अंधजेसती ज्ञानी नय छे के ते सर्वज्ञ कथित छे एटवा हुकीकित कदाचहाल विचारमां न लक्ष्य देपणु ते गराणर समजवामां आवतां तर्क शकित अने विचारणु शकितने पणु दास्य वर्ध नय छे. नहि तो पणी ज्ञान एज उठे के सत्य शा माटे जोालवुं? केवल माटे जोालवुं? तेथी लाल शुं? तेनु परिणाम शुं? तेनो डेतु शुं! आ सर्व ज्ञानाना निर्विद्य उपर लगेल खुशासाथी गराणर वर्ध शके छे. कोई ज्ञापर अंधजेसतुं न आवे तो वधारे विचार करवाची समजाई जशे.

उपरोक्त रीते सत्य, प्रिय, हित, तथ्य अने भित वयन जोालवाची भहु प्रका-  
रना लाल थाय छे, वारंवार नकासुं जोालवानी टेव मटी नय छे, अने तेथी नकासो  
प्रकृतिने व्यय थतो आटके छे. आआ हिवसमां भहु नकासुं जोाल जोाल करवानी  
नकासु आणुसोने टेव होय छे; ऐ कोई पणु रीते लाल करनार नथी. ‘भहु जोाल ते  
नाहो’ ऐ क्षेवत भहु विचारवा येअय छे. विचार कर्यां वगर काळे के अकाळे जोाल-  
वानी टेव होय छे ते कठि पणु चोक्स रीते सत्य जोाली शकता नथी अने स्पष्ट व-  
द्वता वर्ध शकता नथी. एक सुलापितमां कछुं छे के “असत्य पणु प्रिय लाजे तेवु जो-  
लनारा धणु भनुष्यो होय छे पणु अप्रिय के प्रिय गमे तेवुं होय पणु पथ्य वयन  
जोालनार भहु ओएठा होय छे.” अग्र सांलग्नारना हित तरह लक्ष्य राणीकदाय ज-  
शा अप्रिय वयन जोालनारनी पणु प्रशंसा करी छे ते आपणु उपरना सूनने वि-  
द्वय करनार नथी ऐ भहु विचार करीने समजवा येअय छे. हरेक रूपनी अपेक्षा  
समजुने तेनो अमल करवा अने आस करीने पोताने अनुकूल धर्य नय तेवो  
आर्य न करवो, पणु तेनो आशय गराणर विचारी तदनुसार वर्तनं कछुं एज अदे  
भरी सैन्यपणुनी निशानी छे. तेटवा माटे सर्वं संयोग नियारीने वधी रीते  
लाल करनार होय अथवा जरा हुःय लागवानी अपेक्षाचे पणु सांलग्नारने विद्येय  
लाल करनार होय तो तेवुं वयन जोालवुं. सुनने के नोकरने शिखामणु आपतां जरा  
कछुं वयन क्षेवुं पडे तो ते अप्रिय छे पणु तेथी परंपराचे लाल भहु छे, तो  
वयन जोालवानो निवेद नथी. आस करीने असत्य होय अने ते पणु खुद  
लाल आतरज जोालवानुं होय तेवुं वयन तो जोालवुंज नहि. .अपूर्व.

**શ્રીમહદ્યોવિજયલુ કૃત સ્વેપન્ન દેક્કાણકા.**

## દ્વાર્તિશત-દ્વાર્તિશિકા.

આ અપૂર્વ પ્રથ છે. અનેક વિષયોથી ભરપૂર છે. કંચ્છિજ્ઞાણો નિવારી શાબ્દિક દેવદીબાધની આર્થિક સહાયપદે આથાકારે ઘણા ડંગા કાળળખર છ્યપાવી ખણદર પાડેલ છે. મન્યાસલુ આણું દસાગરજીએ શુદ્ધિને માટે પરતો પ્રયાસ કરેલો છે. જૈનપુસ્તક લંડારમાં તથા જૈનશાળા અને પાઠશાળાઓમાં (જ્યાં સંસ્કૃત અભ્યાસ ચાલતો હોય ત્યાં) જેમજ સંસ્કૃતના અભ્યાસી સાધુસાધીને લેટ તરીકે આપવાનો છે. તેના અભિલાષી સાધુ સાધીએ મંગાવવાની કૃપા કરી. પુસ્તક લંડાર ના રક્ષક વિગેરએ પોરટેજ વધુ આના મોકલીને મંગાવી લેવા તરહી લેવી.

તંની

## નવાણુ યાત્રાનો અનુભવ.

અમારી સભાના પ્રમુખ કુંવરજી આણું જી ગયે વરે શ્રીસિદ્ધાચળ મહાતીર્થની નવાણુ યાત્રા કરવાનો અપૂર્વ લાલ લીધો તે પ્રસંગે મેળવેલા અનુભવનો. આ લેખ એ તીર્થ સંબંધી અનેક હુકીકત પૂરી પાડે તેવા લગેલો છે. તે બહેળે ભાગે આ માસિકમાં પ્રગટ થયેલ છે. ઉપરાંત શત્રુંભ્ય લધુકલ્પ, મહાકલ્પ તથા લરતચ્છીએ કરેલી સ્તુતિએ વિગેર દ્વારાલ કરેલ છે. પાંચ કારમની આ ખુક કિંમતથી વેચવાની નથી પરંતુ નવાણુ યાત્રા કરવાના અભિલાષીને લેટ તરીકે મોકલવાની છે. પોરટેજ પણ લેવાનું નથી માટે તેના અભિલાષીએ મંગાવી લેવાની તરહી લેવી.

## હર્ષદીયક સમાચાર.

### શ્રી સમેત શિખ્યર તીર્થના સંબંધમાં મળેલો ન્યાય.

આ તીર્થપર ખાંગલા ખાંધવાનો વિચાર ખાંધ રહ્યા પછી તે પહાડ ખરીદ કરવાના સંબંધમાં પ્રયાસ ચાલતાં હિગંભરી ભાઈઓએ છુટા પડીને તે પહાડનો ઈન્જારો લેવા તજવીજ કરી ત્યાંના દેશેનેનંદ ગવર્નર તરફથી લાલ મેળવેલો. એ સંબંધમાં આપણું થયેલા મન્યાયને અંગે લોક પ્રિય અને ન્યાય પરાયણ ગવર્નર જનરલ લોઈ મીન્ડને અરજ કરતાં રેઝ્યુસ આપણું સંપૂર્ણ ન્યાય આપ્યો છે. અને પોતાનું ન્યાયીપણું બતાવી આપી પ્રથમનો ઠરાવ ગેરૂથાજથી ઠરાવ્યો છે. તે સાથે હિગંભર ભાઈઓએ ભરેલી ડીપોઝિટ રકમ પણ માછી આપવા ઠરાવ કરેલો છે. આ સંબંધમાં પ્રયાસ કરવાર સ્વેતાભાર સંપ્રદાયના આગેવાન ગૃહસ્થ્યાને સંપર્ય ધન્યવાદ ઘટે છે.

## શિહેર-પાલીતાણું રેલવે.

જ્યેષ્ઠ તીર્થની યાત્રાનો લાભ કેવા ઈચ્છનારને ગાડે આ બહુ સારી વિદેશી ટ્રેન હુલમાં શિહેરથી સવારના ૭-૩૫ (સ્ટાન્ડ. ટા.) ઉપરોક્તીતાણુંથી સાંજના ધારાખર ૬-૦ (સ્ટાન્ડ. ટા.) ઉપરોક્તો. આમ થવાથી અગ્રસરથી રાત્રીની ક્રાસ્ટ ટ્રેનમાં આવનારને અને રાત્રિની નીકસમાં જનારને પછી પડ્યો. તેમજ કે દિવસે પાલીતાણું પહોંચયો તે દિવસે પણ યાત્રા પડ્યો. બાબુ લુલોએ અવશ્ય આ તીર્થની યાત્રાનો લાભ કેવો.

નાનું પાનસર સ્ટેશન પોલ્યું છે.

હુલમાં ચેચાણું અને અમદાવાદ વચ્ચે આવેલા પાનસર ગામે શ્રીમહાવીર ના અપૂર્વ ણિબ્બનીકણ્ણા છે તેની યાત્રાનો લાભ કેવા માટે સંખ્યાઓંધ મુશ્કેલી જાય છે. તે ગામતું સ્ટેશન ગામથી એક ગાઉ લગભગ દુર હતું તેથી તું અગ્રસર પડતી હતી તે અગ્રસર દુર થના માટે હુલમાં ગામથી તદ્દન નાળું સ્ટેશન પોલવામાં આવ્યું છે. યાના અવશ્ય કરવા લાયક છે.

મુદૃત વધારી છે.

બાબુએ આંકમાં જાહેર કરેલા માંસાહારથી થથી હાનિ ને વનસ્પતિના ગોરાકથી લાખવાળા સેખને આટે એક માસની સુદૃત વધારવામાં આવી છે. જેથી ચોષ પણ હુંથી આવેલા લણો સ્વિકારવામાં આવ્યો.

બાબુએ પુરતકોણી પહોંચ તથા તે સંખ્યાથી વિવેચન આપતા આંકમાં રેલજ અવકાશી આપવામાં આવ્યો.

નવા મેળણદેના નામ.

શિહેરથી નાનસરાંટ એશિવળુ. લાવનગર. લાઈટમેન્ઝાર.

૨ હેઠથી શુનીલાલ જેવિલુ. કોરેસા. પહેલા વર્ગના મેળણર.

૩ પરી મણીલાલ હીમચંદ. " " "

૪ કાશ. દાગળુ શબ્દ. ૨૨૭ જર્ણી. " "

૫ શા. આશચર્ણ હીશચર્ણ. આવેગામ. " "

## અસ્ત્રચંત ખેદકારક સમાચાર.

સંખ્યાથી ચોષસાલ નેન્ચાંદું અકાળ પંચત.

કાંતિક શુદ્ધ ઇ ની રાત્રિએ ઉપર જણાવેલા ગૃહસ્થ દેખના અતિહુદ્ધ વ્યાધિના રૂગ થઈ પડ્યા છે. એને કાયમના અભ્યાસી, ધર્મિષ્ટ, સરલ અને ખુલેશાળી ના નેગા-નાન ઉપ વર્ષની લખુલયમાં સુત્યુવશ થવાથી સભાએ એક ઉનામ

દા ચોષેણે છે. એમના વડીલ બંધુ દામોદરહાસને તેમજ તેમના હુ-

ંબુદ્ધાદ્ધારી દિવસોણ આપવા સાથે ધર્મકાર્ય તરફ વિશેષ પ્રવૃત્તિ કરવા

એ કારણભૂત શોક ન કરવા સૂચનીએ છીએ.